

Ref: BBY/CS/001/15/24 June 29, 2024

The BSE Limited
Department of Corporate Services,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai - 400 001

Sub: Newspaper Publication of Notice for transfer of equity shares to the Investor Education and Protection Fund (IEPF) Authority

Ref: 1. Scrip Code: 515147

Dear Sir(s)/Madam(s),

In accordance with the Investor Education and Protection Fund (IEPF) Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time, we have published an advertisement in Ahmedabad Edition (Gujarati and English Language) of Financial Express dated June 28, 2024 and in Mumbai Edition of Business Standard dated June 28, 2024 and in Mumbai Edition of Sakal (Marathi) dated June 28, 2024, requesting the concerned shareholders to take appropriate action to claim their dividend, which has not been paid or claimed for seven consecutive years or more, failing which their shares and unclaimed dividend will become liable to be transferred to the IEPF Authority.

In this regard, please find enclosed herewith copies of the advertisement published in the following newspapers:

- 1. Financial Express (Gujarati and English) dated June 28, 2024 Ahmedabad Edition
- 2. Business Standard dated June 28, 2024 Mumbai Edition
- 3. Sakal (Marathi) dated June 28, 2024 Mumbai Edition

Kindly take the same on your record.

Thanking you,

Yours faithfully
For HALDYN GLASS LIMITED

DHRUV MEHTA COMPANY SECRETARY & COMPLIANCE OFFICER ACS-46874

Corporate Office: B-1201, Lotus Corporate Park, Off Western Express Highway, Goregaon (E), Mumbai 400 063
T: +91 22 4287 8999 | F: +91 22 42878910 | E: bombay@haldyn.com

તાતા મોટર્સને આગામી બજેટમાં નીતિને ચાલ્ર રખાય તેવી અપેક્ષા

પીટીઆઇ

નવી દિલ્હી, તા. ૨૭

અને જણાવ્યું હતું કે દેશમાં વર્ષે

એકિસસ બેંક લિમીટેડ

છે. કેન્દ્રમાં નવી એનડીએ સુધી સરકાર ખુબ સ્પષ્ટ છે અને છે કે જ્યાં સુધી આ (ઇલેક્ટ્રિક એક છે.

AXIS BANK કોર્પોરેટ ઓફિસ : એકિસસ બેંક લિમીટેડ, ત્રીજો માળ, ગીગા પ્લેકસ, એનપીસી-૧, ટીટીસી ઈન્ડસ્ટ્રીયલ એરીયા, મુગલસન રોડ, એરોલી, નવી મુંબઈ-૪૦૦૭૦૮

સરકાર આગામી મહિને કેન્દ્રીય દેશમાં ઇલેક્ટ્રીક પરિવહનના વ્હિકલ) ઉદ્યોગ આત્મનિર્ભર ન બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. પ્રવેશ વધારવાને ટેકો આપે છે. બને ત્યાં સુધી નીતિ ચાલુ રહેશે. તાતા મોટર્સે આજે જણાવ્યું કેન્દ્ર સરકાર હાલના વર્ષોમાં અમે જીએસટી અને પીએલઆઇ તેમણે જણાવ્યું હતું કે ઇવી હતું કે તે આવનારા બજેટમાં ૧લી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રિય જેવા સંપૂર્ણ યોજના ધરાવીએ જગ્યામાં ૧૫-૨૦ ટકા પ્રવેશ સરકારની નીતિ યથાવત બજેટરજૂ કરે છે. જોકે, ૨૦૨૪ છીએ. તાતા મોટર્સ પેસેન્જર સ્તર ન પહોંચે ત્યા સુધી નીતિ રહેવાની અપેક્ષા રાખી રહી છે. ચૂંટણીનું વર્ષ હોવાને પગલેચાલુ વ્હિકલ એન્ડ તાતા પેસેન્જર ચાલુ રહેવી જોઇએ અને ઉમેર્યું ફેબ્રુઆરીમાં ફક્ત ઇલેક્ટ્રીક મોબિલિટીની એમડી હતું કે ચાર્જીંગ માળખા તરફ ઇલેક્ટ્રિક પરિવહનને ઝડપથી વચગાળાનું બજેટ રજૂ કરવામાં શૈલેષ ચંદ્રાએ પત્રકારોને નીતિ ટેકા પર વધુ મજબૂત ધ્યાન અપનાવવા માટે ચાર્જીંગ માળખા આવ્યું હતું. તેથી અત્યાર સુધી જણાવ્યું હતું કે તેથી અમે કેન્દ્ર કેન્દ્રિત કરવું જોઇએ. જે ઇવી ક્ષેત્રમાં વધુ ખેલાડીઓની જરૂર બજેટની અપેક્ષાનો સંબંધ છે ત્યા સરકાર બજેટમાં અપેક્ષા રાખી પ્રવેશ માટેના અવરોધોમાંથી

દેશના સાત શહેરોમાં આવાસોનું

પી ટીઆઈ

નવી દિલ્હી .તા. ૨૭

એપ્રિલથી જૂનના ગાળા દરમિયાન આવાસોનું વેચાણ વાર્ષિક ધોરણે પાંચ ટકા ઊંચકાઈને આશરે ૧.૨

લાખ યુનિટ્સ નોંધાયું હતું, જ્યારે અગ્રણી હરોળની હાઉસિંગ ભાવોમાં ઊછાળો આવતાં ગત બ્રોકરેજ કર્મ એનારોકે ગુરુવારે દેશનાં સાત મોટાં શહેરોમાં ત્રિમાસિકગાળાની તુલનામાં માગ એપ્રિલથી જૂનના ત્રિમાસિકગાળા ૮ ટકા ગગડી હોવાનું એનારોકે માટે હાઉસિંગ માર્કેટનો ડેટા તે સમયે ૧.૩૦ લાખ કરતાં વધુ જણાવ્યું હતું.

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ તથા

પ્રસિદ્ધ કર્યો હતો.

એપ્રિલથી જૂન, ૨૦૨૪માં ટોચનાં સાત શહેરોમાં આવાસોનાં એક વર્ષમાં પ્રોપર્ટીના ભાવોમાં વેચાણો પાંચ ટકા ઊંચકાઈને ૧,૨૦,૩૪૦ યુનિટ્સ થયાં હોવાનો અંદાજ છે, જે વર્ષ ભાવમાં ઊછાળો આવવાને કારણે અગાઉના સમાન ગાળામાં ૧,૧૫,૦૯૦ યુનિટ્સ રહ્યાં બ્રેક મારી દીધી છે, એમ પુરીએ હતાં.જોકે, જાન્યુઆરીથી માર્ચના સમજાવ્યું હતું. ત્રિમાસિક ગાળામાં 9.30.990 વેચાણો રહ્યાં હતાં. તેની સામે સમીક્ષા હેઠળના ગાળામાં વેચાણોમાં ૮ ટકાનો ઘટાડો જોયો છે, જ્યારે ચેમ્નઈ તથા નોંધાયો હોવાની ધારણા છે. એનારોકના ચેરમેન અનુજ પુરીએ નોંઘાવ્યો કહ્યું હતું કે, આવાસોનાં વેચાણોમાં છે.

જોવા મળેલો ઘટાડો ગત ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા ઓલ ટાઈમ હાઈ બેઝને આભારી છે, કારણ કે, યુનિટ્સનું વેચાણ થયું હતું.

અગત્યની વાત એ છે કે, છેલ્લા સારો એવો વધારો થયો હોવાથી પણ આ ઘટાડો જોવા મળ્યો છે. ઘણા રોકાણકારોએ ખરીદી પર

વાર્ષિક ધોરણે દિલ્હી-યુનિટ્સનાં એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન િરિજન (એમએમઆર), બેંગાલુરુ, પૂણે, હૈદરાબાદે વેચાણમાં વધારો કોલકાતાએ માગમાં ઘટાડો

₩ Haldyn Glass:::

હલ્ડીન ગ્લાસ લીમીટેડ

CIN: L51909GJ1991PLC015522 કોર્પોરેટ ઓકીસ : બી-૧૨૦૧, લોટસ કોર્પોરેટ પાર્ક, ઓક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ગોરેગાંવ (ઇસ્ટ), મંબઇ-૪૦૦૦૬૩. ક્ષેના : ૦૨૨ - ૪ ૨૯૭(૦૦૦, ફેક્સ : ૦૨૨ - ૪ ૨૯૭(૦૦, ૧૦૧) જો. એફીસ : ગામ ગવાસદ , તાલુકો-પાદસ, નિર્ણ-વડોદસ, ગુજરાત-૩૯૧૪૩૦, ફ્રોન : ૨૬૨૨ ૪૪૩૩૩૦, ફેક્સ : ૨૬૨૨ ૪૫૦૮૧

નોટીસ (ઇન્વેસ્ટર એજ્યુકેશન અને પ્રોટેક્શન ફંડ (આઇઇપીએફ)

ઓથોરીટીમાં કંપનીના ઇક્વીટી શેરોની તબદીલી) આથી હલ્ડીન ગ્લાસ લીમીટેડ ("કંપની") ના શેરહોલ્ડરોને ઇન્વેસ્ટર એજ્યુકેશન અને પ્રોટેક્શન ફંડ ઓથોરીટી (એકાઉન્ટીંગ, ઓડિટ, ટ્રાન્સફ્ર્સ અને રીફંડ) નિયમો, ૨૦૧૬, સુંધારા મુજ્બ (નિયમો) ના નિયમ દુ સાથે વંચાતા કંપની કાયદા ૨૦૧૩ ની કલમ ૧૨૪ (દુ) ની જોગવાઇઓ મુજબ નોટીસ આપવામ

આવે છે. **નિયમો, અન્ય બાબતોની સાથેસાથે સતત સાત વર્ષ અથવા** વધુ વર્ષોથી શેરહોલ્ડરો દ્વારા જેડિવિડન્ડર્ન ચુકવર્ણો કરાઇ નથી કે શેરહોલ્ડરો દ્વારા દાવો કરાયો નથી તેને સબંધિત તમામ શેરોની ઇન્વેસ્ટર એજ્યુકેશન અને પ્રોટેક્શન ફંડ (આઇઇપીએફ) ઓથોરીટીના એકાઉન્ટમાં તબદીલીની જોગવાઇએ ધરાવે છે.

નિયમોમાં જણાવેલ વિવિધ આવશ્યકતાઓનું પાલન કરીને કંપની સત્વરે ડિવિડન્ડોનાં તમામ શેરો વ નાણાંકિય વર્ષ ૨૦૧૪–૧૫ અથવા તે પહેલાથી સતત સાત કે તેથી વધુ વર્ષથી ન ચુકવાયેલ અથવા દાવ રહીત છે. તેમને સંબંધિત નિયત તારીખોએ આઇઇપીએક ઓથોરીટીમાં તબદીલ કરેલ છે. કંપનીએ તેના પત્ર તારીખ ર૪૧૬ન, ૨૦૨૪,(૨૫ ૧૬ન, ૨૦૨૪ ના રોજ રવાના) દ્વારા તમામ લાગતા વળગતા શેરહોલ્ડર જેમના શેર નાણાંકિય વર્ષ ૨૦૨૩–૨૪ દરમિયાન આઇઇપીએફ ઓથોરીટીને તબદીલ કરવા પાત્ર છે તેમને ચોગ્ય કાર્ચવાહી કરવા માટે વ્યક્તિગત રીતે જાણ કરી છે.

કંપનીએ આવા શેરહોલ્ડરો અને આઇઇપીએ કુ ઓથોરીટીમાં તબદીલીને પાત્ર શેરોની સંપૂર્ણ વિગતો તેને વેબસાઇટ <u>www.haldynglass.com</u> પર અપલોડ કરી છે.

શેરહોલ્ડરોએ નોંધ લેવી કે આઇઇપીએફ એકાઉન્ટ/આઇઇપીએફ પ્રાધિકરણમાં તબદીલ કરાયેલ દાવા રહીત ડિવિડન્ડ અને શેર્સ બંને આવા શેરો પ્રાપ્ત તમામ કાયદાઓ, જો કોઇ હોય તો, તેના સહીત રહેશે અને લાગતા વળગતા શેરહોલ્ક્ટો નિયમો હેઠળ જ્યાવેલ પ્રક્રિયા અનુસરીને આઇઇપીએફ પ્રાધિકરણ પાસેથી તેને પરત મેળવવા દાવો કરી શકે છે.

લાગતા વળગતા શેરહોલ્ક્સે જે ફીઝીકલ ફોર્મમાં શેરો ધરાવે છે અને જેમના શેરો આઇઇપીએફ ઓથોરીટીમાં તબદીલીને પાત્ર છે તેમણે નોંધ લેવી કે કંપની નિયમો મુજબ આઇઇપીએફ ઓથરીટીમાં શેરોની તબદીલી અને ડીમટીરીયલાછોશનના હેતુસર તેની પાસે રહેલ ઓરીજનલ શેર સર્ટીફીકેટ(ટો) ની બદલીમાં ડુપ્લીકેટ શેર સર્ટીફિકેટ(ટો) જારી કર્ર્શે અને આવા સર્ટીફીકેટ જારી થયા પછી, તેમના નામે ૨૯ેલ ઓરી જેનલ શેર સર્ટીફીકેટ(ટો) સ્વચં ૨દ થશે અને બિનવટાઉ ગણાશે. શેરહોલ્ડરોએ વધુમાં નોંધ લેવી કે કંપનીએ તેની વેબસાઇટ પર અપલોડ કરેલ વિગતો નિયમો મુજ્બ આઇઇપીએફ ઓથોરીટીમાં શેરોની તબદીલીના હેતુસર કંપની દ્વારા નવા સર્ટી ફીકેટ(ટો) જારી કરવા સંબધિત પર્યાપ્ર નોટીસ તરીકે

જો કંપનીને રદ્દ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી અથવા એ પહેલા લાગતા વળગતા શેરહોલ્ડરો પાસેથી કોઇ માહીતી (દાવારહિત/ ન યુકવેલ ડિવિડન્ડનો દાવો) મળશે નહી તો, કંપની નિયમોમાં જણાવેલ આવશ્ચકતાઓનું પાલન કરવા માટે નિયમોમાં જણાવેલ પ્રક્રિયા અનુસરીને કોર્પોરેટ કાર્ચવાહીના માર્ગ આછપીએફ ઓથોરીટીમાં કીમટીરીચલાછ્ઝ અને શેરોની તબદીલી કરશે.

શેરહોલ્ડરોને વિષય સબંધીત કોઇ પ્રશ્નો હોયતો તેઓ કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સ ફર એજન્ટ મેસર્સ લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રા.લી., સી-૧૦૧, ૨૪૭ પાર્ક, એલબીએસ રોડ, વિપ્રોલી વેસ્ટ, મુંબઇ ૧૦૦૦૮૩. ટેલી. નં. +લ્૧ ૨૨ ૪૯૧૮૬૦૦૦, ફેક્સ નં. + ૯૧ ૨૨ ૪૯૧૮૬૦૬૦ ઇ–મેંઇલ **હલ્ડીન ગ્લાસ લીમીટેડ** વતી rnt.helpdesk@linkintime.co.in ઉપર સંપર્ક કરી શકે છે.

કોર્મ જી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ માટે આમંત્રણ (રાઉન્ડ ૨) ચુનાઈટેડ ન્યુઝ ઓફ ઇન્ડિયા ન્યુઝ એજન્સી તરીકે કાર્ચરત (ન્યુઝ/મીડીયા ઇન્ડસ્ટ્રીમાં) (ઇન્સોલ્વેન્સી અને બેંક્ટપ્ટસી (કોર્પોરેટ પર્સન્સ માટેઇન્સોલ્વેન્સી રીઝોલ્યુશન પ્રક્રિયા) નિયમનો, ૨૦૧૬ ના નિયમન ૩૬એ(૧) હેઠળ) સબંધિત વિગતો

युनार्धहेड न्युञ ओङ् छन्डिया PAN:AAATU0641B CIN: U92200DL1959NPL003169

૯ રફી માર્ગ, ન્યુ દિલ્હી-૧૧૦૦૦૧

રૂા. ૭ કરોડ અંદાજીન (અન ઓડિટેડ) સબસ્કાઈવરની સંખ્યા (બિલ્ડ) :૪૧૦ પે્ઈંગ સબસ્કાઈબરની સંખ્યાઃ ૩૪૬

tp://www.uniindia.com/cirp.asp

http://www.uniindia.com/cirp.aspx

૧૩ જુલાઈ, ૨૦૨૪

૧૮ જુલાઈ, ૨૦૨૪

રક જુલાઈ, ૨૦૨૪

રદ્દ જુલાઈ, ૨૦૨૪

ર દસોગસ્ટ. ૨૦૨૪

http://www.uniindia.com/ મિલકનો દિલ્હી, હૈદરાબાદ, ભોપાલ, નાસિક, મુંબઈમાં આવેલ છે

વલાકમાં ૧૦૧૧. ક્રાટનાં, જેપાસ, મહતું કું નુધાને બાલલ છે. નોહ: મોટાભાગની વિલકનો લિવેલ લીટીગેલન્સ હેઠલ સબ-જ્યુડીક્ષ (વિલાડીન(લ્રો-વીનગેન્સ એસેટો લીઝડ એસેટો/ટેન્સી હકો/લીઝલોલ્ડ હકો છે. પ્રભ વિગનો આરપી પાસેથી મંગલી ક્રાકો સિદ્ધમીડે દેલાદાર તે ઇન્સ્ટોલ્ડ કેપેલીટી નિર્ણાદીનું નથી, પરંતુ સિદ્ધમીડે દેલાદાર દેશની

જુની બહુભાષી ન્યુઝ એન્સીઓમાં થી એક છે. જે આશ્વરે ૪૬૦ સબરકાઈબર ઘરાવે છે - ૨૦૨૧-૨૨ ના સરવેયા મુજબ કામકાજોમાંથી આવકઃ ગ્રા. ૮,૬૫,૧૦,૯૯૬/-- ૨૦૨૨-૨૭ ના મેનેજ મેન્ટ દારા પુરા પડાયેક્ષ ડેટા મુજબ કામકાજોમાંથી આવકઃ રૂા. ૬.૭૩,૪૯.૧૦૩/-– ૨૦૨૩-૨૪ ના મેનેજમેન્ટ દારા પુરા પડાયેલ ડેટા મુજબ કામકાજોમાંથી આવકઃ

તાવ. માર્ચ, ૨૦૨૨ ના રોજ પુરા થતાં વર્ષના ઓડિટેડ સરવૈયા તેમની એજીએમમાં મંજુર થયા નથી. માર્ચ,૨૦૨૩ના રોજ પુરા થતાં વર્ષના ઓડિટેડ સરવૈયા ક્ષેરમની ઉણપ લીથી એજએમમાં મંજુર થયેલ નથી. સીઆઈઆરપીની શરૂઆતની તારીખ મુજબ સરવૈયા અંતિમ છે, પરંતુ ઓડિટેડ નથી. ૩૧ માર્ગ, ૨૦૨૪ મુજબના સસ્ત્રેયા કાઈનલાઈઝ કરાયેલ છે. નિયમિત કર્મચારીઓ: ૧૯૭ (૧૯.૫.૨૦૨૩ મુજબ), ૧૭૨ (તારીખ મુજબ) કરારી કર્મચારીઓ : ૭૫ (૧૯.૫.૨૦૨૩ મુજબ), ૧૯(તારીખ મુજબ)

સ્થળ : મુંબઇ તારીખ : ૨૭ જુન , ૨૦૨૪

ક્રોપેરિટ દેવાદારનું નામ તેમજ પૅન/સીઆઇએન/એલએલપી નં

રજીસ્ટર્ડઓફીસનું સરનામું

. વેબસાઇટનો યુઆરએક . સ્થળની વિગનો જ્યાં મોટાભાગની

કર્મચારીઓ/કાર્યકર્તાઓની સંપ વધુ વિગનો તેમજ બે વર્ષના ઉપલબ્ધ નાણાંકિય નિવદેનો, કેડીટરોર્ન

યાદી, પ્રક્રિયાના આગામી કાર્યક્રમોની સંબંધિત તારીખો ઉપક્ષબ્ધ છે. ક્રોડની ક્લમ ૨૫(૨) (એચ) હેઠળ રીઝોલ્યુશન અરજદારોની લાયકાન

કામચલા ઉપાદી જારી કરવાની નારીખ કામચલાઉ યાદી જારી કરવાની નારીખ કામચલાઉ યાદીમાં વાંઘાઓ જમા કરવાની છેલી નારીખ

૧૩. ભાવી રીઝોલ્યશન અરજદારોની અંતિમ

યાદી જારી કરવાની નારીખ માહીની મેમોરેન્ડમ, મુલ્યાંકન મેટ્રીક્સ અને ભાવી રીઝોલ્યુશન અરજદારનો રીઝોલ્યુશન પારજદારનો

. રીઝોલ્યુશ્ર પ્લાન જમા કરવાની છેલી તારીખ

૧૧. ભાવી રીઝોલ્યુશન અરજદારોની

ડંગમ મિલકનો આવેલ છે

મુખ્ય ઉત્પાદનો/સેવાઓની ઇન્સ્ટોલ્ડ ક્રેપેસીટી

ધ્રવ મેહના કંપની સેક્રેટરી

માંગણી સૂચના

અમે, એક્સિસ બેંક લિમિટેડ (અગાઉ યુટીઆઈ બેંક લિમિટેડ તરીકે ઓળખાતી હતી.) (હવેથી "ઘ બેંક" તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે) તેની રજિસ્ટર્ડ ઓફિસ ત્રિશૂલ, સામર્થેશ્વર કોમ્પ્લેક્સની સામે, લો ગાર્ડન, એલિસબ્રીજ, અમદાવાદ - 380006 અન્ય સ્થળો એક્સિસ બેંક લિમિટેડ, પ્રથમ માળ, બોલેક્વર એવન્યુ, એસ જી હાઇવે, રાજપાય ક્લબની સામે, બડકદેવ, અમદાવાદ, ગુજરાત - 380054 ધરાવે છે અને આ રીતે સિક્યોર્ડ ક્રેડિટર તરીકેની તેની ક્ષમતામાં ઉપરોક્ત કાયદાની કલ્ભ 13 (2) હેઠળ નોટિસ આપશે, જ્યારે અહીં ઉલ્લેખિત ઋણધારકો/ગેરેન્ટર્સ/મોર્ગેજરોએ એક્સિસ બેંક લિ. અમે જણાવીએ છીએ કે નાણાકીય સહાયની લાભ લીધો હોવા છતાં. ઋણ લેનારાઓ/ગેરેન્ટર્સ/મોગૅજરોએ નિયત તારીખ અનુસાર વ્યાજ અને મુદ્દલની રકમની પુનઃચુકવણીમાં ડિફોલ્ટ કર્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા નિર્દેશો / માર્ગદર્શિકાઓ અનુસાર આ ખાતાને અહીં ઉલ્લેખિત તારીખ નોન પરફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એક્સિસ બેંક લિમિટેડના અધિકારીને સિક્યોરિટાઇઝેશન અન્ડ રિકન્સ્ટ્રેક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફ્રોસિમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટેસ્ટ એક્ટ - 2002 હેઠળ પ્રદાન કરવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને અને કલમ 13(12) હેઠળ પ્રદાન કરવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, જે સુરક્ષા હિત (અમલીકરણ) નિયમો, 2002ના નિયમ 3 સાથે વાંચવામાં આવે છે, જેણે ધિરાણ લેનારાઓ / સહે-ઋણધારકો / ગેરેન્ટર્સ / મોર્ગેજર્સને નીચે જણાવેલી તારીખો પર ફાઇનાન્સ એસેટ્રસની કલમ 13 (2) હેઠળ નીચે જણાવેલ તારીખો પર ડિમાન્ડ નોટિસ ફટકારી છે. વ્યાજ અધિનિયમ - 2002 ઉપરોક્ત નોટિસમાં ઉલ્લેખિત રકમની ચુકવણી કરારના દર, ખર્ચ, ચાર્જ અને આનુપંગિક ખર્ચ વગેરે પર વધુ વ્યાજ સાથે ચૂકવવા માટે જો કે નોટિસો પરત કરવામાં આવી હતી અને તેથી તેમને આ અંગે જાહેર નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે.

વ્યાજ	અધિનિયમ - 2002 ઉપરાંક્ત નાટિસમાં ઉલ્લીખેત રકમની ચુકવણો કરારના દર, ખર્ચ, ચાર્જ અને આનુર્ષોગંક ખર્ચ વગેરે પર	વધુ વ્યાજ સાથ ચૂકવવા માટ	: જો કે નીટિસી પરત કરવા	ામાં આવી હતી અને તેથી તેમને આ અંગે જાહેર નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે.
ક. ન.	કરજદાર અને સહ - કરજદાર / જામીનદારનું નામ અને સસ્નામું અને લોન ખાતા નંબર	ડીમાન્ડ નોટીસની તારીખ અને NPA ની તારીખ	ડીમાન્ડ નોટીસ મુજબ બાકી સ્કમ (રૂ ા. માં)	મિલકત નું વર્ણન
1	(૧) દિનેશભાઈ દયારામભાઈ ઠાકર (એપ્લીકેન્ટ/મોર્ગેજર) રઘુનંદન સોસાયટી, જીઈબી પાસે, પાવર હાઉસ પાછળ, ગામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - ગ્રાઉન્ડ ફ્લોર, દુકાન નં ૧ થી ૮, મહાવીર હોસ્પિટલ પાસે, વોર્ડ નં.૩, સલારી નાકા, રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - ફ્લેટ નં.૧૦૮, પશ્વભાવન સંકુલ, વિકાસ વાડી સામે, રાપર ગામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પ્લીટ નં.૧૬, ત્રાંબો રોડ, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પ્લીટ નં.૧૬૩, ત્રાંબો રોડ, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પ્લોટ નં.૨, રઘુનંદન સોસાયટી, રાપર ગામ, જિલ્લો કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - પ્લોટ નં.૨, રઘુનંદન સોસાયટી, રાપર ગામ, જિલ્લો કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - પ્લોટ નં.૨, રઘુનંદન સોસાયટી, રાપર ગામ, જિલ્લો કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પ્લોટ નં.૨, મહાવીર હોસ્પિટલ પાસે, વોર્ડ નં.૩, સલારી નાકા, રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પ્લોટ નં.૨, રઘુનાનધન સોસાયટી, ચોર્ડ નં.૩, સલારી નાકા, રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પ્લોટ નં.૨, રઘુનાનધન સોસાયટી, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પ્લોટ નં.૨, રઘુનાનધન સોસાયટી, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - આઈનાઝ ફૃપા, શ્રેયસનાથ સોસાયટી, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - આર્કન લી ટ, મહાવીર હોસ્પિટલ પાસે, વોર્ડ નં.૩, સલારી નાકા, રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - આર્કન કલેટ, ન ૧૦૮, પશ્વભાવન સંફુલ, વિકાસ વાડી સામે, રાપર ગામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - પ્લોટ નં.૧, રઘુનાનધન સોસાયટી, ગામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - પ્લોટ નં.૨, રઘુનાનધન સોસાયટી, ગામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - પ્લોટ નં.૨, રઘુનાનધન સોસાયટી, અપ્રોપણ - પ્લોટ નં.૧, રઘુન તે ૧૦૮, પશ્વભાવન સંકુલ, વિકાસ વાડી સામે, રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - પ્લોટ નં.૨, રઘુનાનધન સોસાયટી, ગામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - પ્લોટ નં.૨, રઘુનાનધન સોસાયટી, ગામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - પ્લોટ નં.૨, રઘુનાનધન સોસાયટી, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - પ્લોટ નં.૨, રઘુનાનધન સોસાયટી, મામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - પ્લોટ નં.૨, રઘુનાનધન સોસાયટી, ગામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આર્કી પણ - પ્લોટ નં.	02-12-2021 & 01-09-2021	30-11-2021	ગુણધર્મ: ૧ - તમામ ભાગ અને હિસ્સા સાથે ની સ્થાવર મિલકત પ્લોટ નં૧, રાપર નગરપાલિકા ૨૬/૨૯/૧૩ પાઇકી ઉત્તરીય ભાગ ૧૧૨.૪૦ ચોરસ મીટર અને પ્લોટ ને૧ રાપર નગરપાલિકા ૨૬/૨૯/૧૪ પાઇકી ૯૧.૯૭ ચોરસ મીટર (કુલ વિસ્તાર ૨૦૪.૩૭ ચોરસ મીટર)ની સાથે ૮ કોમર્શિયલ દુકાનના બાંધકામ સાથે ૯૧.૯૭ ચોરસ મીટર (કુલ વિસ્તાર ૨૦૪.૩૭ ચોરસ મીટર)નું વાવેતર કરેલ છે. ચતુઃ સીમા - 1.દુકાન નં.2 રાપર નગર સેવા સદન નં.26/29/14/3, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 2. દુકાન નં.3 રાપર નગર સેવા સદન નં.26/29/14/4, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 3. દુકાન નં.4 રાપર નગર સેવા સદન નં.26/29/14/5, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 5. દુકાન નં.6 રાપર નગર સેવા સદન નં.26/29/14/6, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 7. દુકાન નં.6 રાપર નગર સેવા સદન નં.26/29/14/7, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 8. દુકાન નં.6 રાપર નગર સેવા સદન નં.26/29/14/7, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.6 રાપર નગર સેવા સદન નં.26/29/14/7, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.7 રાપર નગર સેવા સદન નં.26/29/14/7, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.1 રાપર નગર સેવા સદન નં.26/29/14/2, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.1 રાપર નગર સેવા સદન નં.26/29/14/2, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.1 રાપર નગર સેવા સદન ને.26/29/14/2, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.1 રાપર નગર સેવા સદન ને.26/29/14/2, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.1 રાપર નગર સેવા સદન ને.26/29/14/2, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.1 રાપર નગર સેવા સદન ને.26/29/14/2, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.1 રાપર નગર સેવા સદન ને.26/29/14/2, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.1 રાપર નગર સેવા સદન ને.26/29/14/2, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.1 રાપર નગર સેવા સાથે ને સ્થાય સાથે ની સ્થાવર મિલકત પ્લીટ નં.૧, નગરપાલિકા નં પ્રપ/૧૩૬, વોર્ડ નં.૭, સર્વ નંદપાલ મહેલા રહેણાં ક્રાલ, વરત, ૧૨૧,૧૦૦ ચોરસ મીટરના વિસ્તાર, રચુનંદન સોસાયટી, રાપર ખાતે આવેલ ક્રેલ્ય સદન નં.૨૩/૫૮/૩૧, રેવ્યુ સર્વા સદન નં.૩/૫૮/૩૧, રેવ્યુ સર્વા સદન નં.૩/૧, વિસ્તાર અદ્ર ને.૨૦૦ ચોરસ મીટરના છે. ચાર સીધા - પૂર્વ : ૭,૫૦ મીટર સોડ, વેસ્ટ : રોડ, વેસ્ટ : રોડ, ઉત્તર : પ્લીટ નંબર પ્રદુશ સ્થાય મા
2.	(૧) પિયુપકુમાર રસીકલાલ ઉડેયા (અરજદાર) રથુનંદન સોસાયટી, જીઈબી પાસે, પાવર હાઉસ પાછળ, ગામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - ગ્રાઉન્ડ ફ્લોર, દુકાન નં.૧ થી ૮, મહાવીર હોસ્પિટલ પાસે, વોર્ડ નં.૩, સલારી નાકા, રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - ફલેટ નં.૧૦૮, પગ્નભાવનસંકુલ, વિકાસ વાડી સામે, રાપર ગામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પ્લોટ નં.૧૬૩, ત્રાંબો રોડ, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પલોટ નં.૧૬૩, ત્રાંબો રોડ, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. (૨) પ્રવીણકુમાર દયારામ 658ર (સહ- અરજદાર/મોર્ગજર) રથુનંદન સોસાયટી, જીઈબી પાસે, પાવર હાઉસ પાછળ, ગામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - ૧૧૪, અચોધ્યાપુરી, પગ્નભવન પાસે, રાપર, કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પાય, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - કલેટ નં ૧૦૮, પગ્નભાવન સંકુલ, વિકાસ વાડી સામે, રાપર ગામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પ્લોટ નં ૧૬૩, ત્રાંબો રોડ, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આપ્ર મામ - પણ - મે૧૬૩, ત્રાંબો રોડ, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. આપ્ર મામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પ્લોટ નં ૧૬૩, ત્રાંબો રોડ, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પલોટ નં.૧૬૩, ત્રાંબો રોડ, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પલોટ નં.૨, રથુનાનથન સોસાયટી, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - આઈનાઝ ફ્યા, શ્રેયતનાથ સોસાયટી, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - આઈનાઝ ફયા, શ્રેયતનાથ સોસાયટી, અયોધ્યાપુરી, રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - આઈનાઝ ફયા, શ્રેયતનાથ સોસાયટી, અયોધ્યાપુરી, રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - આઈનાઝ ફયા, શ્રેયતનાસે, રાપર, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - આઈનાઝ ફયા, શ્રેયતનાથ મોસાયટી, અયોધ્યાપુરી, રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પલોટ નં.૧૬૩, ત્રાંબો રોડ, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પ્લોટ નં.૧૦૮, પગ્નભાવન સંકુલ, વિકાસ વાડી સામે, રાપર ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પલોટ નં.૧૯૩, ત્રાંબો રોડ, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પલોટ નં.૧૯૩, ત્રાંબો રોડ, ગામ રાપર, જિલ્લા કચ્છ-૩૭૦૧૬૫. અહીં પણ - પલોટ નં.૧૬૩, ત્રાં	02.12.2021 & 01-09-21	as on	ગુણ્થમં: ૧ - તમામ ભાગ અને હિસ્સા સાથે ની સ્થાવર મિલકત પ્લોટ નં.૧, રાપર નગરપાલિકા ૨૬/૨૯/૧૩ પાઇકી ઉત્તરીય ભાગ ૧૧૨.૪૦ ચોરસ મીટર અને પ્લોટ નં.૧ રાપર નગરપાલિકા ૨૬/૨૯/૧૪ પાઇકી ૯૧.૯૭ ચોરસ મીટર (કુલ વિસ્તાર ૨૦૪.૩૭ ચોરસ મીટર)ની સાથે ૮ કોમર્શિયલ દુકાનના બાંધકામ સાથે ૯૧.૯૭ ચોરસ મીટર (કુલ વિસ્તાર ૨૦૪.૩૭ ચોરસ મીટર)નું વાતેતર કરેલ છે. ચતુઃ સીમા - 1.દુકાન નં.2 રાપર નગર સેવા સદન નં.26/29/14/3, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 2. દુકાન નં.3 રાપર નગર સેવા સદન નં.26/29/14/4, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 3. દુકાન નં.3 રાપર નગર સેવા સદન નં.26/29/14/5, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 4. દુકાન નં.5 રાપર નગર સેવા સદન નં.26/29/14/5, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 5. દુકાન નં.5 રાપર નગર સેવા સદન નં.26/29/14/7, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 7. દુકાન નં.6 રાપર નગર સેવા સદન નં.26/29/14/7, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 8. દુકાન નં.7 રાપર નગર સેવા સદન નં.26/29/14/7, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 8. દુકાન નં.1 રાપર નગર સેવા સદન નં.26/29/14/9, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 8. દુકાન નં.1 રાપર નગર સેવા સદન નં.26/29/14/2, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 8. દુકાન નં.1 રાપર નગર સેવા સદન નં.26/29/14/2, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 8. દુકાન નં.1 રાપર નગર સેવા સદન નં.26/29/14/2, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.1 રાપર નગર સેવા સદન નં.26/29/14/2, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.1 રાપર નગર સેવા સદન નં.26/29/14/2, વોર્ડ નં.3 સેલારી નાકા રાપર-કચ્છ. 9. દુકાન નં.1 તમામ ભાગ અને હિસ્સા સાથે ની સ્થાવર મિલકત પ્લોટ નં.૧ ૧૨૩, રોપ માં પૂર્વ : ૭.૫૦ મીટર પોડ સે પોટ નં ૧૪, દિલણ પ્લોટ નં.૨ નગરપાલિકા નં.૧૫/૧૩૬, વોર્ડ નં.૭, સર્વ નં.૯૫/૧ ધરાવતા રહેણાંક મકાન, ૧૨૧.૬૦ ચોરસ મીટરના વિસ્તાર, રધુનંદન સોસાયટી, રાપર ખાતે આવેલ. જિલ્લા કચ્છ બાંધકામ વિસ્તાર ૪૮.૦૦ ચોરસ મીટરના છે. ચતુઃ સીમા - પૂર્વ : ૭.૫૦ મીટર રોડ, વેસ્ટ : રોડ, ઉત્તર : પ્લોટ નંબર ૧, દિલણ: પ્લોટ નં.૩ વરાર નં.૨૩ વરાર સોવા સદન નં.૨૩/પ૮/૩૧, રેવ્યુ સર્વે નં.૩/૨, વિસ્તાર ૭૬,૭૩ ચોરસ મીટર, રાપર-કચ્છ. ચતુઃ સીમા - પૂર્વ : બાંક નં.૧૦ રને અને આટી. એસ., પશ્ચિમ : ઓ.ટી.એસ. અને ત્યારબાદ બ્લોક નં.૧૦૦, ઉત્તર : સ્લાટ ને.૨૩ ચોર સ્લાટ ને.૨૩ સ્લાદ ને.૨૦ સ્લાટ ના સાત્ર સાત્ર સાત
3	(૧) રાજેશકુમાર દયારામભાઈ ઠક્કર (એપ્લીકેન્ટ) ૪૬, ચામુંડા સોસાયટી, કોલેજ રોડ વિલાર્ધનપુર, તાલુકા રાધનપુર, જિલ્લો પાટણ- ૩૮૫૩૪૦. અહીં પણ - પ્લોટ નં.૨૧ રઘુનંદન સોસાયટી, સાંખિયાળી રોડ રાપર, જિલ્લા કચ્છ- 370165. અહીં પણ - પ્લોટ નં.૨૧ રઘુનંદન સોસાયટી, સાંખિયાળી રોડ રાપર, જિલ્લા કચ્છ- 370165. અહીં પણ - નગરપાલિકાનું મકાન નં.૨૪/૧૦૪/૧, અયોધ્યાપુરી, મહાવીરનગર, સલારી નાકા પાસે, રાપર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ-૩૦૦૧૬૫. (2) બસંતલાલ દયારામભાઈ ઠક્કર (કો-એપ્લીકેન્ટ/મોર્ગેજર) આઈનાઝ કૃપા, શ્રેયશનાથ સોસાયટી, અયોધ્યાપુરી, રાપર, કચ્છ- 370165. અહીં પણ - પ્લોટ નં.૧૨, રઘુનંદન સોસાયટી, સંખિયાળી રોડ, રાપર, જિલ્લો કચ્છ- 370165. અહીં પણ - નગરપાલિકાનું મકાન નં.૨૪/૧૦૪/૧, અયોધ્યાપુરી, મહાવીરનગર, સલારી નાકા પાસે, રાપર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ-૩૦૦૧૬૫. (3) પ્રમાબેન સ્શીકલાલ ઠક્કર (સહ-અરજદાર/ગીરવે મૂકનાર) રઘુનંદન સોસાયટી, સંખિયાળી રોડ, રાપર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ-370165. અહીં પણ - પ્લોટ નં.15, રઘુનંદન સોસાયટી, સંખિયાળી રોડ, રાપર, જિલ્લો કચ્છ-370165. અહીં પણ - પ્લોટ નં.15, રઘુનંદન સોસાયટી, સંખિયાળી રોડ, રાપર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ-370165. અહીં પણ - પ્લોટ નં.૧૨, રઘુનંદન સોસાયટી, સંખિયાળી રોડ, રાપર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ-300૧૬૫. (8) માયાબેન રાજેશભાઈ ઠક્કર (સહ-અરજદાર) ૪૬, ચામુંડા સોસાયટી, સંબિયાળી રોડ, રાપર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ-370165. અહીં પણ - પ્લોટ નં.૨૧, રઘુનંદન સોસાયટી, સંબિયાળી રોડ, રાપર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ-370165. અહીં પણ - પ્લોટ નં.૨૧, રઘુનંદન સોસાયટી, સંબિયાળી રોડ, રાપર, જિલ્લો કચ્છ-370165. અહીં પણ - મારાયી સાથી રાપર, જિલ્લો કચ્છ-370165. અહીં પણ - નગરપાલિકાનું મકાન નં.૨૪/૧૦૪/૧, અયોધ્યાપુરી, મહાવીરનગર, સલારી નાકા પાસે, રાપર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ-300૧૬૫. લોન નં9180301040000859	02.12.2021 & 01.09.2021	11622008 & 25829.99 as on 30-11-2021	મિલકત: 1. તમામ ભાગ અને હિસ્સા સાથે ની સ્થાવર મિલકત રહેણાંક મકાનનો પ્લોટ નં ૨૧, આર.એસ.નં.૯૫૫/૧-પી, નગરપાલિકા નં ૪૬/૫, ૧૩૫.૬૦ ચોરસ મીટરમાં આવેલ રઘુનંદન સોસાયટી, રાપર, ગામ રાપર, તાલુકા રાપર, જિલ્લા કચ્છ ખાતે આવેલ છે. ચતુઃ સીમા - પૂર્વ : ૭.૫૦ મીટર રોડ, પશ્ચિમ : પ્લોટ નં ૧૪, ઉત્તર : પ્લોટ નં ૨૦, દક્ષિણ : પ્લોટ નં ૨૨. મિલકત: 2 તમામ ભાગ અને હિસ્સા સાથે ની સ્થાવર મિલકત રહેણાંક મકાનનો પ્લોટ નં ૧૫, રેવન્યુ સર્વે નં.૯૫૫/૧-પી, વોર્ડ નં.૭, ૧૫૦.૭૪ ચોરસ મીટર, રઘુનંદન સોસાયટી, સામખિયાળી રોડ, ગામ રાપર, તાલુકો રાપર, જિલ્લા કચ્છ. ચતુઃ સીમા - પૂર્વ : પ્લોટ નં.૨૦, પશ્ચિમ : ૭.૫ મીટર રોડ, ઉત્તર : ૭.૫ મીટર રોડ, દક્ષિણ : પ્લોટ નં.૧૪. મિલકત: 3 - તમામ ભાગ અને હિસ્સા સાથે ની સ્થાવર મિલકત નગરપાલિકાના મકાન નં.૨૪/૧૦૪/૧, વોર્ડ નં.૦૪ ઉપર રહેણાંક મકાન, ૧૨૦.૫૮ ચોરસ મીટર, મહાવીર નગર, હનુમાન શેરી, ગામ રાપર, તાલુકો રાપર, જિલ્લા કચ્છ. ચતુઃ સીમા - પૂર્વ: શેરી, પશ્ચિમ: ઠક્કર ખુશાલભાઈ પ્રેમજી અને સોની કેહવેલલ યુથલ નું મકાન ઉત્તર: સોની હિમતલાલ બાબુલાલ નું મકાન દક્ષિણ : પુષ્પાબેન ક્રાંતિલાલ ઠાકર નું મકાન
4	1. તિરાજલાલ ગોકળભાઈ મધુકિયા (અરજદાર) ૭૫, શ્યામ કૃષ્ણ સોસાયટી, સેટેલાઇટરોડ, મહાદેવ ચોકપાસે, મોટા વરાછા, સુરત-૩૯૪ ૧૦૧. 2. નિમુબેન ઘીરુબાઈ મધુકીયા (સહ-અરજદાર) ૭૫, શ્યામ કૃષ્ણ સોસાયટી, સેટેલાઇટરોડ, મહાદેવ ચોકપાસે, મોટા વરાછા, સુરત-૩૯૪ ૧૦૧. 3. કેવલ ઘીરુબાઈ મયુકીયા (સહ-અરજદાર) ૭૫, શ્યામ કૃષ્ણ સોસાયટી, સેટેલાઇટરોડ, મહાદેવ ચોકપાસે, મોટા વરાછા, સુરત-૩૯૪ ૧૦૧. લોન નં 918030042689453 & 918030042689479	12.06.2024 & 07.10.2021	on 27.02.2021 & Rs 19,02,594.7/- as	ચુણધર્મ ૧ - દુકાન નં.૧૪, ૧" ફ્લોર પાઇકી સાઇટ મુજબ, દુકાન નં.૧૦૩૦, ૧" માળનું એક્ઝોઝિંગ ૪૯૦.૪૩ સ્ક્વેર ફીટ, યુપર બિલ્ટ અપ એરિયા અને ૩૧૨.૬૯૧ સ્કવેર ફીટ, એટલે કે ૨૯.૦૪ ચોરસ મીટર, "પ્લાન ખી' વિંગ મુજબના માનસરોવર પ્લાઝાની જમીનમાં અવિભાજિત હિસ્સા સાથે બિલ્ટ અપ એરિયા, રેવન્યુ સર્વે નં.૬૮૩, રેવન્યુ સર્વે નં.૬૮૩ માં આવેલ, બ્લોક નંપપo/એ, એક્ઝેઝિંગ ૭- ૩૮-૧૩ સ્ક્વેર મીટર આકાર રૂ.૨૯.૮૯ પૈસા, મોજે કથોર, તાલુકો -કામરેજ જિલ્લો-સુરત, ઇમારતના સામાન્ય વિસ્તારોનો ઉપયોગ કરવાનો અધિકાર, પાણીના કબાટ, ડ્રેનેજ, લવટોરીઝ અને અન્ય સુવિધાઓ અને સુવિધાઓનો ઉપયોગ કરવાનો અધિકાર, ફ્લેટ / યુનિટ / ઓફિસ પરિસરમાં અથવા તેની સાથે સંબંધિત અથવા તેની સાથે જોડાયેલી સુવિધાઓ, બંને વર્તમાન અને ભવિષ્ય બંને તમામ ફિક્સર અને ફિટિંગ્સ સાથે મળીને ચતુ: સીમા - પૂર્વ : પાર્કિંગ અને ખુલ્લી જમીન, પશ્ચિમ : સીઓપી જમીન અને મકાન એ- દુ અને એ-૭ મિલકત, ઉત્તર : વિંગ સીપોર્ટી, દક્ષિણ: સોસાયટી રોડ ગુણધર્મ - ૨ - દુકાન નં નજ, ૧" માળ પાઇકી, સાઇટ શીપ નં.૧૦૩૧, ૧" ફ્લોર મુજબ, પ૪૮.૪૨૪ સ્કવેર ફીટ સુપર બિલ્ટ અપ એરિયા અને ૩૫૦.૫૮ સ્કવેર ફીટ, એટલે કે ૩૨.૫૭ ચોરસ મીટર, "સાઇટ 'બી' વિંગ મુજબના માનસરોવર પ્લાઝાની જમીનમાં અવિભાજિત હિસ્સા સાથે બિલ્ટ અપ એરિયા, રેવન્યુ સર્વે નં ૬૮૩ માં સ્થિત પ્લાન બિલ્ડિંગ નં.એફ. બ્લોક નંપપo/એ, એડમીસીંગ ૭ - ૩૮-૧૩ સ્કવેર મીટર આકાર રૂ.૨૯.૮૯ પૈસા, મોજે કઠોર, તાલુકો - કામરેજ, જિલ્લો-સુરત, સાથે સાથે ઇમારતના સામાન્ય વિસ્તારોનો ઉપયોગ કરવાનો અધિકાર, પાણીના કબાટ, ડ્રેનેજ, લવટોરીએ અને અને સુવિધાઓ અને સુવિધાઓ અને સુવિધાઓ ન્કલેટ / યુનિટ / ઓફિસ પરિસરમાં અથવા તેની સાથે સાથે સાથે તેની તેમામ ફિક્સર અને ફિટિંગ્સ, ચતું: સીમા - પૂર્વ : પાર્કિંગ અને ખુલ્લી જમીન, પશ્ચિમ : સીઓપી જમીન અને મકાન એ-ફ અને એ-૭ મિલકત, ક્લિંગ સાથે સ્ત્રીને સ્થાર સાથે કર્યા સાથે મળીને તમામ ફિક્સર અને ફિટિંગ્સ, ચતું: સીમા - પૂર્વ : સાર્કિંગ અને ખુલ્લી જમીન, પશ્ચિમ : સીઓપી જમીન અને મકાન એ-ફ અને એ-૭ મિલકત, ક્લિટાની સીપોર્ટ : સિકાન સાથે કર્યા સ્તર : સીચાન સાથે મળીને તમામ ફિક્સર અને ક્લિટાન સાથે મારે સાથે કર્યા સાથે કર્યા સાથે કર્યા સાથે કર્યા સાથે કર્યા કર્યા કર્યા સ્ત્રી સાથે કર્યા સાથે કર્યા સાથે કર્યા સાથે સાથે સાથે સાથે માર્યા સાથે સાથે કર્યા સાથે સાથે સાથે સાથે સાથે સાથે સાથે સાથ
5	1. મેસર્સ વીવીએન ઇમ્પેક્સ (અરજદાર) એ-૮૦૩, શિવ પ્લાઝા, કઠોદરા રોડ, નવજીવન હોટલ સામે, સરથાણા જકાત નાકા, વરાછા રોડ, સુરત-૩૯૫૦૦૬. 2. રીટાબેન અશોકભાઈ કોસટ (પ્રોપસઇટર) એ-૮૦૩, શિવ પ્લાઝા, કઠોદરા રોડ, નવજીવન હોટલ સામે, સરથાણા જકાત નાકા, વરાછા રોડ, સુરત-૩૯૫૦૦૬. 3. અશોકકુમાર પરસોત્તમભાઈ કોરાટ (જામીનદાર) એ-૮૦૩, શિવ પ્લાઝા, કઠોદરા રોડ, નવજીવન હોટલ સામે, સરથાણા જકાત નાકા, વરાછા રોડ, સુરત-૩૯૫૦૦૬. લોન નં 919030016239805	12.06.2024 & 27.06.2021	40,82,993,7 as on 24.02.2021	ચુણધર્મ ૧- તમામ ભાગ અને હિસ્સા સાથે ની એન.એ પ્રોપર્ટી બેરિંગ ફ્લેટ નં એ-803, 8મો માળ, બિલ્ટ અપ એરિયા 58.43 ચોરસ મીટર જેટલો છે અને સુપર બિલ્ટ અપ એરિયા 90.58 ચોરસ મીટર જેટલો છે, જે "શિવ બલાઇ"માં 26.19 ચોરસ મીટર જેટલો છે અને સુપર બિલ્ટ અપ એરિયા 90.58 ચોરસ મીટર જેટલો છે, જે "શિવ બલાઇ"માં 26.19 ચોરસ મીટર જેટલો અવિભાજિત શેર વિસ્તાર 1228 સ્કલેર મીટર, પ્રફ્ર ટી.પી. સ્કીમ નંબર 21 (સરથાણા-સિમકા) ને અહીને આવેલા એફ.પી. નં 75/1, તેનું કુલ કદ 5723 ચોરસ મીટર, પ્રોશ્ટ ફર્કાર, પાર્શીના કબાટ, ટ્રેનેજ અને જિલ્લો સુરત.સાથે સાથે ઇમારતના સામાન્ય વિસ્તારોનો ઉપયોગ કરવાનો અધિકાર, પાણીના કબાટ, ડ્રેનેજ, લવટોરીઝ અને અન્ય સુવિધાઓ અને સુવિધાઓ, ફ્લેટ / યુનિટ / ઓફિસ પરિસરમાં અથવા તેની સાથે સંબંધિત અથવા તેની સાથે જોડાયેલી સુવિધાઓ, વર્તમાન અને ભાવિ અને સરળ બંને અધિકારો અને વર્તમાન અને ભવિષ્ય બંને તમામ ફિક્સર અને ફિટિંગ્સ સાથે ચતુઃ સીમા - પૂર્વ : ખુલ્લું સ્થળ, દક્ષિણ : ફ્લેટ નં એ-૮૦૪. ચુણધર્મ - ૨ - તમામ ભાગ અને હિસ્સા સાથે ની એન એ. પ્રોપર્ટી ધરાવતી દુકાન નં 2, બીજો માળ, સુપર બિલ્ટ અપ એરિયા 530 ચોરસ ફૂટ અને બિલ્ટ અપ એરિયા 27.88 ચોરસ મીટર જેટલો બિલ્ટ અપ એરિયા. સબ પ્લોટ નં ડી /1 ની પશ્ચિમ બાજુએ બાંધવામાં આવેલ "ગ્લોબલ પોઇન્ટ"(દેવન્યુ રેકોર્ડ મુજબ તેનો બ્લેક /સર્વે નંબર 153/3/પાઇકી /કી -1) વિસ્તાર 1540 ચોરસ મીટરનો વિસ્તાર, બ્લોક નંબર 153-બી અને રેવન્યુ સર્વે નં 159/3 પર સ્થિત છે. તેની ટી.પી. યોજના નં 22 (સરથાણા-વાલાક), એફ.પી. નં 11+12, પેટા જિલ્લા પુણા (સુરત શહેર), જિલ્લો સુરત અને મથાનાના અધિકાર સાથે મળીને ઇમારતના સામાન્ય વિસ્તારોનો ઉપયોગ કરો, પાણીના કબાટનો ઉપયોગ કરવાનો અધિકાર, ડ્રેનેજ, લેવેટોરીઝ અને અન્ય સુવિધાઓ અને સુવિધાઓ. ફ્લેટ યુનિટ ઓફિસ પરિસરમાં અથવા તેની સાથે સંબંધિત અથવા તેની સાથે સંબંધિત કર્યા કર્યા કર્યા મોત્રાને અને ભવિષ્ય બંને તમામ ફિક્સર અને ફિટિંગ્સ સાથે સાંબે અને અને ભવિષ્ય બંને તમામ ફિક્સર અને ફિટિંગ્સ સાથે સાથે સાંબે અને તમાન અને ભવિષ્ય બંને તમામ ફિક્સર અને ફિટિંગ્સ સાથે સાથે સાથે સાથે સાથે તેના તમાન અને ભવિષ્ય બંને તમામ ફિક્સર અને ફિટિંગ સાથે સાંબેધિત અવલ સાથે સાથે સાથે સાથે સાથે સાથે સાથે સાથે

અધિકૃત અધિકારી, એક્સિસ બેંક લિ

કૃપા કરીને વધુ નોંધ લેશો કે ઉપરોક્ત અધિનિયમની કલમ 13 ની પેટા-કલમ 13 માં ઉલ્લેખ કર્યા મુજબ, તમે જામીનગીરી હેઠળ જણાવેલી કોઈપણ સંપત્તિને વેચાણ, ભાડા પટ્ટા અથવા અન્યથા સ્થાનાંતરિત કરી શકશો નહીં અમારી બેંકની આગોતરી લેખિત સંમતિ વિના આ નોટિસમાં ર્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તારીખ-28.06.2024, સ્થળ-ગુજરાત નોંધ:(વિવાદ ની સ્થિતીમાં અંગ્રેજી આવૃતિને માન્ય રાખવામાં આવશે) તળદીલી માટે આવશ્ચ કતા મુજબ આવી મંજુરી મેળવવા પોતે જવા છાં. નોંધ: રીઝોલ્યુશન મંગાવવા માટેની પ્રક્રિયા ૫ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ શરૂ કરાઇ હતી (૧૧ રાપ્ટેમ્બર, ૨૦૨૩ સું

પઝા બાહર્ર યુનાઇટેક વ્યુઝઓફ ઇન્ડિયાના રીઝોલ્યુશનપ્રોફેશનલ આઇપી રજીસ્ટ્રેશન નં .: IBBI/IPA-003/IP-N0007/2016-2017/10063 એએક્એ નં. AA3/10063/02/271124/301037 ૨૭.૧૧.૨૦૨૪ સુધી માન્ય

. ઈઓઆઈ જમા કરવા માટે પ્રોસેસ cirp.unitednewsonfindia@gmail.com ઇમેઇલ આઇડી : અગત્યની નોંધ અને ખુલાસો – નોંધ લેવી કે ચુના ઇટેક ન્યુઝ ઓફ ઇન્ડિયા વર્ષ ૧૮૫૯માં કંપની કાચદા, ૧૯૫૬ ની કલમ રપ હેઠળ ચેરીટેબલ હેતુઓ ધરાવતી કંપની તરીકે સંસ્થાપિત કરાઈ હતી. રીઝોલ્યુશન અરજદાર નોટ– ફોર પ્રોફીટ ટુ પ્રોફીટ મેકીંગ ું કુંગી પાસેથી કોર્પોરેટ દારને કન્વર્ટ કરવા અથવા કોર્પોરેટ દેવાદારના શ્રેસે લેવા માંગે છે તેઓ લાગુ કાયદાઓ કાજેતરની એ ફ્કીઆઇ પોલીસી, આઇબીસીની જોગવાઇઓ મુજબ થથા ચોગ્ચ રીતે શેર્રોના સંપાદન અને

૧૩ ઓક્ટો બર , ૨૦૨૩ ના રોજપ્રસિદ્ધ કરાચેલ ઈઓઆઈ માટેના વધુ આમંત્રણો સાથે), આમ છતાં, કેડીટરોર્ન કમીટીએ લીધેલ નિર્ણને આધારે રીઝો લ્યુગન પ્લાન જમા કરવા માટે ઇંગોલે મંગાવવા માટે રંપુણી રીઝોલ્યુગન પ્રક્રિયાનો રાઉન્ડ– ર હવે શરૂ કરાયો છે. ઉપરોક્ત ફોર્મ જી (રાઉન્ડ ૨) ૧૩ સપ્ટેમ્બર, રન્ટર સુધી નામદાર એ નસીટએલટીએ મંજુર કરેલ સીઆઈઆરપી ગાળાના લંબાણ પછી પ્રસિદ્ધ કરાચેલ છે. ારીખ અને સ્થળ: ૨૮ જુન, ૨૦૨૪, નવી દિલ્હી

> સરનામું: ૫૯/૨૭, પ્રભાત રોક, ન્યુ રોહતાક રોક, નવી દિલ્હી-૧૧૦૦૦૫. ફોન: ૯૮૧૧૦૭૧૭૧ ઈમેઈલ: cirp.united newsofindia@gmail.com, pujabahry@yahoo.c

U GRO CAPITAL LIMITED U GRO

4th Floor, Tower 3, Equinox Business Park, LBS Road, Kurla, Mumbai 400070 POSSESSION NOTICE APPENDIX IV (See rule 8(1)) (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of UGRO Capital Limited, having its registered office at 4th Floor, Tower 3, Equinox Business Park, LBS Road, Kurla, Mumbai 400070, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of the powers conferred under Section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice to repay the amount mentioned in the notice together with interest thereon, within 60 days from the date of receipt of the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of Section 13 of the Act read with Rule 8 of the said rules of the Security Interest (Enforcement) Rules 2002 on the day, month and year mentioned below. The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of UGRO Capital Limited for the amount mentioned in the notice together with interest thereon. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

1) GENUINE MOTOR REPOWERING SERVICE 2) ARIFBHAI MHEBUBBHAI MAKRANI 3) TASLIM ARIFBHAI MAKRANI Loan Account Number: UGMRBTH0000004676

BORROWER DETAILS

Demand Notice Date and Amount POSSESSION DATE Demand Notice dated 18-03-2024 for an amount of Rs. 50,59,543/- (Rupees Fifty 25-06-2024 Lakh Fifty-Nine Thousand Five Hundred and Forty-Three Only) as on 15-03-2024

Mortgaged Property: All that the pieces and parcels of immovable property comprising of Commercial Godown Admeasuring area 119-17 Sq. Mtrs (Built-up Area 65-05 Sq. Mtrs) of Plot no.5 of Revenue survey No.207 Paiki of Village Mahendranagar, Taluk - Morbi, In the Registration District of Morbi, in Gujarat Division. Date: 28.06.2024. Place: Gujarat

SD/- Ramlal Gupta - Authorised Officer - UGRO Capital Limited



For the Indian Intelligent.

AXIS BANK

Axis Bank Ltd. (CIN: L65110GJ1993PLC020769)

Corporate Office: Axis Bank Ltd., 3rd Floor, Gigaplex, NPC – 1, TTC Industrial Area, Mugalsan Road, Airoli, Navi Mumbai – 400 708.

Demand Notice

We, Axis Bank Ltd. (formerly known as UTI Bank Ltd.) (hereinafter referred to as "The Bank") having its Registered Office at Trishul, Opp. Samartheswar Templex, Law Garden, Ellisbridge, Ahmedabad - 380006 among other places Axis Bank Ltd., 1st Floor, Balleshwar Avenue, S G Highway, Opp. Rajpath Club, Badakdev, Ahmedabad, Gujarat - 380054 and do hereby give the notice under Section 13(2) of the aforesaid Act in its capacity as Secured Creditor, Whereas the Borrowers / Guarantors / Mortgagors mentioned hereunder had availed the financial assistance from Axis Bank Ltd. We state that despite having availed the financial assistance. The Borrowers / Guarantors / Mortgagors have committed defaults in repayment of interest and principal amounts as per due dates. The Account have been classified as Non Performing Asset on the date mentioned hereunder in accordance with the directives / Guidelines issued by reserve Bank of India. Consequent to the Authorised Officer of Axis Bank Ltd. under Security Interest Act - 2002 & in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest Act - 2002 & in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest Act - 2002 & in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest Act - 2002 & in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest Act - 2002 & in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest Act - 2002 & in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest Act - 2002 & in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest Act - 2002 & in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest Act - 2002 & in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest Act - 2002 & in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest Act - 2002 & in exercise Officer of Ac Interest (Enforcement) Rules, 2002 issued demand notice to borrowers / Co - Borrowers / Guarantors / Mortgagors on the dates mentioned herein below under section 13(2) of Securitisation and Reconstruction of Finance Assets and Enforcement of Security interest Act - 2002 to pay the amount mentioned in the said notice together with further interest at the contractual rate, costs, charges and incidental expenses etc however the notices were returned served and as such they are hereby informed by way of public notice about the same.

SF		Demand Notice Date & NPA Date	Outstanding Amount (Rs.) as per Demand Notice	Description of the Mortgaged Property / Security Assets
1	(1) DINESHBHAI DAYARAMBHAI THAKKAR (APPLICANT/MORTGAGOR) AT. RAGHUNANDAN SOCIETY, NR. GEB, B/H. POWER HOUSE, VILL.RAPAR, TA.RAPAR, DIST.KACHCHH-370165. Also at - GROUND FLOOR, SHOP NO. 1 TO 8, NR. MAHAVIR HOSPITAL, WARD NO.3, SALARI NAKA, AT. RAPAR, DIST.KACHCHH-370165. Also at - FLAT NO.108, PADMABHAVAN COMPLEX, OPP. VIKAS WADI, AT.VILL. RAPAR, TA.RAPAR, DIST.KACHCHH-370165. Also at - PLOT NO.163, TRAMBO ROAD, VILL.RAPAR, DIST.KACHCHH-370165. Also at - PLOT NO.2, RAGHUNANDHAN SOC., AT. VILL.RAPAR, DIST.KACHCHH-370165. (2) SURESHKUMAR DAYARAMBHAI THAKKAR (CO-APPLICANT) 46, CHAMUNDA SOCIETY, COLLEGE ROAD, RADHANPUR, PATAN-385340. Also at - GROUND FLOOR, SHOP NO. 1 TO 8, NR. MAHAVIR HOSPITAL, WARD NO.3, SALARI NAKA, AT. RAPAR, DIST.KACHCHH-370165. Also at - FLAT NO.108, PADMABHAVAN COMPLEX, OPP. P. VIKAS WADI, AT.VILL. RAPAR, TA.RAPAR, R. DIST.KACHCHH-370165. Also at - PLOT NO.2, RAGHUNANDHAN SOC., AT. VILL.RAPAR, DIST.KACHCHH-370165. (3) SACHIN RASHIKLALTHAKKAR (CO-APPLICANT) AT. RAGHUNANDAN SOCIETY, NR. GEB, B/H. POWER HOUSE, VILL.RAPAR, KACHCHH-370165. Also at - AAINAJ KRUPA, SHREYASNATH SOCIETY, AYODHYAPURI, RAPAR, KACHCHH-370165. Also at - FLAT NO.108, NR. MAHAVIR HOSPITAL, WARD NO.3, SALARI NAKA, AT. RAPAR, DIST.KACHCHH-370165. Also at - FLAT NO.108, NR. MAHAVIR HOSPITAL, WARD NO.3, SALARI NAKA, AT. RAPAR, DIST.KACHCHH-370165. Also at - FLAT NO.108, NR. MAHAVIR HOSPITAL, WARD NO.3, SALARI NAKA, AT. RAPAR, DIST.KACHCHH-370165. Also at - PLOT NO.2, RAGHUNANDHAN SOC., AT. VILL.RAPAR, DIST.KACHCHH-370165. AJ VASANTLAL DAYARAMBHAI THAKKAR (CO-APPLICANT/MORTGAGOR) AT. RAGHUNANDAN SOCIETY, NR. GEB, B/H. POWER HOUSE, VILL.RAPAR, DIST.KACHCHH-370165. Also at - PLOT NO.2, RAGHUNANDHAN SOC., AT. VILL.RAPAR, DIST.KACHCHH-370165. AJ VASANTLAL DAYARAMBHAI THAKKAR (CO-APPLICANT/MORTGAGOR) AT. RAGHUNANDAN SOCIETY, NR. GEB, B/H. POWER HOUSE, VILL.RAPAR, DIST.KACHCHH-370165. AJ VASANTLAL DAYARAMBHAI THAKKAR (CO-APPLICANT/MORTGAGOR) AT. RAGHUNANDAN SOCIETY, NR. GEB, B/H. POWER HOUSE, VILL.RAPAR, DIST.KACHCHH-370165. AJ SO AT.	02-12-2021 & 01-09-2021	as on	PROPERTY: 1 - ALL THAT PIECES AND PARCEL OF IMMOVABLE PROPERTY ON PLOT NO.1, RAPAR MUNICIPAL 26/29/13 PAIKI NORTHERN PART ADMEASURING 112.40 SQ. MTRS. AND PLOT NO.1 RAPAR MUNICIPAL 26/29/14 PAIKI ADMEASURING 91.97 SQ. MTRS (TOTAL AREA OF 204.37 SQ. MTRS) ALONG WITH THE CONSTRUCTION OF 8 COMMERCIAL SHOP. THE BOUNDARIES ARE US UNDER: 1. SHOP NO.2, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/3, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 2. SHOP NO.3, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/4, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 3. SHOP NO.4, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/5, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 4. SHOP NO.5, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/7, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 5. SHOP NO.5, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/7, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 6. SHOP NO.7, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/9, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 7. SHOP NO.8, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/9, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/9, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/2, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/2, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/2, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/2, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/2, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/2, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/2, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/2, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/2, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/3, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/3, WARD NO.3, SELARI NAK
22	(1) PIYUSHKUMAR RASHIKLAL UDECHA (APPLICANT) AT. RAGHUNANDAN SOCIETY, NR. GEB, B/H. POWER HOUSE, VILL RAPAR, TA.RAPAR, DIST. KACHCHH-370165. ALSO AT - GROUND FLOOR, SHOP NO. 1 TO 8, NR. MAHAVIR HOSPITAL, WARD NO.3, SALARI NAKA, AT. RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - FLAT NO.108, PADMABHAVAN COMPLEX, OPP. VIKAS WADI, AT.VILL. RAPAR, TA.RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - PLOT NO.163, TRAMBO ROAD, VILL.RAPAR, DIST.KACHCHH-370165 ALSO AT - PLOT NO.2, RAGHUNANDHAN SOC., AT. VILLRAPAR, DIST.KACHCHH-370165. (2) PRAVINKUMAR DAYARAM THAKKAR (CO-APPLICANT/MORTGAGOR) AT. RAGHUNANDAN SOCIETY, NR. GEB, B/H. POWER HOUSE, VILL.RAPAR, TA.RAPAR, DIST. KACHCHH-370165. ALSO AT - 114, AYODHYAPURI, NR. PADMABHAVAN, RAPAR, KACHCHH-370165. ALSO AT - FLAT NO.108, PADMABHAVAN COMPLEX, OPP. VIKAS WADI, AT.VILL. RAPAR, TA.RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - FLAT NO.108, PADMABHAVAN COMPLEX, OPP. VIKAS WADI, AT.VILL. RAPAR, TA.RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - PLOT NO.2, RAGHUNANDHAN SOC., AT. VILLRAPAR, DIST.KACHCHH-370165, ALSO AT - PLOT NO.2, RAGHUNANDHAN SOC., AT. VILLRAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - PLOT NO.2, RAGHUNANDHAN SOC., AT. VILLRAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - AAINAJ KRUPA, SHREYASNATH SOCIETY, AYODHYAPURI, RAPAR, KACHCHH-370165. ALSO AT - GROUND FLOOR, SHOP NO. 1 TO 8, NR. MAHAVIR HOSPITAL, WARD NO.3, SALARI NAKA, AT. RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - PLOT NO.2, RAGHUNANDHAN SOC., AT. VILL.RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - PLOT NO.2, RAGHUNANDHAN SOC., AT. VILL.RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - PLOT NO.2, RAGHUNANDHAN SOC., AT. VILL.RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - PLOT NO.2, RAGHUNANDHAN SOC., AT. VILL.RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - PLOT NO.3, SALARI NAKA, AT. RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - PLOT NO.3, SALARI NAKA, AT. RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - PLOT NO.3, SALARI NAKA, AT. RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - PLOT NO.3, SALARI NAKA, AT. RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - FLAT NO.108, PDWER HOUSE, VILL.RAPAR, TA.RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - FLAT NO.	02.12.2021 & 01-09-21	& 22672.31 as on	PROPERTY: 1 - ALL THAT PIECES AND PARCEL OF IMMOVABLE PROPERTY ON PLOT NO.1, RAPAR MUNICIPAL 26/29/13 PAIKI NORTHERN PART ADMEASURING 112.40 SQ. MTRS. AND PLOT NO.1 RAPAR MUNICIPAL 26/29/14 PAIKI ADMEASURING 91.97.SQ. MTRS (TOTAL AREA OF 204.37 SQ. MTRS) ALONG WITH THE CONSTRUCTION OF 8 COMMERCIAL SHOP. THE BOUNDARIES ARE US UNDER: 1. SHOP NO.2, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/3, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 2. SHOP NO.3, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/4, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 3. SHOP NO.4, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/5, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 4. SHOP NO.5, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/6, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 5. SHOP NO.6, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/7, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 6. SHOP NO.7, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/9, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 7. SHOP NO.8, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/9, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/2, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. 8. SHOP NO.1, RAPAR NAGAR SEVA SADAN NO.26/29/14/2, WARD NO.3, SELARI NAKA RAPAR-KACHCHH. EAST: ROAD, WEST - 15 FT WIDE INTERNAL ROAD, NORTH - PLOT OF AMBAVI BHURA PATEL, SOUTH - PLOT NO.13 PAIKI OF KALAVANTIBEN MAGANLAL SUTHAR. PROPERTY: 2 - ALL THAT PIECES AND PARCEL OF IMMOVABLE PROPERTY ON PLOT NO.163, ADMEASURING 84 SQ. MTRS. OF R.S. NO.20/1, SITUATED AT VILL RAPAR, TA. RAPAR, DIST. KACHCHH AND BOUNDED AS UNDER: EAST: 7.50 MTR WIDE ROAD, WEST - PLOT NO.140, NORTH - PLOT NO.164, SOUTH: PLOT NO.162. PROPERTY: 3 - ALL THAT PIECES AND PARCEL OF IMMOVABLE PROPERTY ON RESIDENTIAL HOUSE CONSTRUCTED ON PLOT NO.2, MU. NO.45/136, WARD NO.7, BEARING SURVEY NO.955/1, ADMEASURING 121.60 SQ. MTRS. SITUATED AT RAGHUNANDAN SOCIETY, RAPAR, DIST.KACHCHH CONSTRUCTION AREA IS 48.00 SQ. MTRS. AND BOUNDED AS UNDER: EAST: 7.50 MT. ROAD, WEST - ROAD, NORTH - PLOT NO.1, SOUTH - PLOT NO.3. PROPERTY: 4 - ALL THAT PIECES AND PARCEL OF IMMOVABLE PROPERTY OF THE HOUSE NO.108, RAPAR NAGAR SE
3	(1)RAJESHKUMAR DAYARAMBHAI THAKKAR (APPLICANT) AT. 46, CHAMUNDA SOCIETY, COLLEGE ROAD, VILRADHANPUR, TA.RADHANPUR, DIST.PATAN- 385340. ALSO AT - PLOT NO.21 RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT.RAPAR, DIST.KACHCHH- 370165. ALSO AT - PLOT NO.15 RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT.RAPAR, DIST.KACHCHH- 370165. ALSO AT - MUNI. HOU. NO.24/104/1, AYODHYAPURI, MAHAVIRNAGAR, NR. SALARI NAKA, AT. RAPAR, TA.RAPAR, DIST.KACHCHH-370165. (2)VASANTLAL DAYARAMBHAI THAKKAR (CO-APPLICANT/MORTGAGOR) AAINAJ KRUPA, SHREYASHNATH SOC., AYODHYAPURI, RAPAR, KACHCHH- 370165. ALSO AT - PLOT NO.21, RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT. RAPAR, DIST. KACHCHH- 370165. ALSO AT - PLOT NO.15, RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT.RAPAR, DIST.KACHCHH- 370165. ALSO AT - MUNI. HOU. NO.24/104/1, AYODHYAPURI, MAHAVIRNAGAR, NR. SALARI NAKA, AT. RAPAR, TA.RAPAR, DIST.KACHCHH-370165. (3) PUSHPABEN RASHIKLAL THAKKAR (CO-APPLICANT/MORTGAGOR) RAGHUNANDAN SOCIETY, NR. GEB, B/H. POWER HOUSE, AT.RAPAR, DIST.KACHCHH-370165. ALSO AT - PLOT NO.21, RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT. RAPAR, DIST.KACHCHH- 370165. ALSO AT - PLOT NO.15, RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT.RAPAR, DIST.KACHCHH- 370165. ALSO AT - PLOT NO.15, RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT.RAPAR, DIST.KACHCHH- 370165. ALSO AT - PLOT NO.21, RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT.RAPAR, DIST.KACHCHH- 370165. ALSO AT - PLOT NO.21, RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT.RAPAR, DIST.KACHCHH- 370165. ALSO AT - PLOT NO.21, RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT.RAPAR, DIST.KACHCHH- 370165. ALSO AT - PLOT NO.15, RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT.RAPAR, DIST.KACHCHH- 370165. ALSO AT - PLOT NO.15, RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT.RAPAR, DIST.KACHCHH- 370165. ALSO AT - PLOT NO.15, RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT.RAPAR, DIST.KACHCHH- 370165. ALSO AT - PLOT NO.15, RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT.RAPAR, DIST.KACHCHH- 370165. ALSO AT - PLOT NO.15, RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, AT.RAPAR, DIST.KACHCHH - 370165. ALSO AT - PLOT NO.15, R	02.12.2021 & 01.09.2021	11622008 & 25829.99 as on 30-11-2021	PROPERTY: 1. ALL THAT PIECES AND PARCEL OF IMMOVABLE PROPERTY ON RESIDENTIAL HOUSE PLOT NO.21, R.S. NO.955/1-P, MUNI. NO.46/5, ADMEASURING 135.60 SQ. MTRS.SITUATED AT.RAGHUNANDAN SOCIETY, VIL RAPAR, TA.RAPAR, DIST.KACHCHH AND BOUNDED AS UNDER: EAST: 7.50 MT. ROAD, WEST: PLOTNO.14, NORTH: PLOT NO.20, SOUTH: PLOT NO.22. PROPERTY: 2. ALL THAT PIECES AND PARCEL OF IMMOVABLE PROPERTY ON RESIDENTIAL HOUSE PLOT NO.15, REVENUE SURVEY NO.955/1-P, WARD NO.7, ADMEASURING 150.74 SQ. MTRS. SITUATED AT.RAGHUNANDAN SOCIETY, SAMKHIYALI ROAD, VILL.RAPAR, TA.RAPAR, DIST.KACHCHH AND BOUNDED AS UNDER: EAST: PLOT NO.20, WEST: 7.5 MT ROAD, NORTH: 7.5 MT ROAD, SOUTH: PLOT NO.14. PROPERTY: 3 ALL THAT PIECES AND PARCEL OF IMMOVABLE PROPERTY ON RESIDENTIAL HOUSE ON MUNICIPAL HOUSE NO.24/104/1, WARD NO.04, ADMEASURING 120.58 SQ. MTRS. SITUATED AT.MAHAVIR NAGAR, HANUMAN SHERI, VILL.RAPAR, TA.RAPAR, DIST.KACHCHH AND BOUNDED AS UNDER: EAST: STREET, WEST: HOUSE OF THACKER KHUSHALBHAI PREMJI & SONI KEHAVLAL JUTHALAL, NORTH: HOUSE OF SONI HIMATLAL BABULAL, SOUTH: HOUSE OF PUSHPABEN KANTILAL THACKER
44	 Dhirajlal Gokalbhai Mathukiya (Applicant) Shyam Krishna Society, Satelight Road, Near Mahadev Chowk, Mota Varachha, Surat-394 101. Nimuben Dhirubhai Mathukiya (Co- Applicant) Shyam Krishna Society, Satelight Road, Near Mahadev Chowk, Mota Varachha, Surat-394 101. Keval Dhirubhai Mathukiya (Co- Applicant) Shyam Krishna Society, Satelight Road, Near Mahadev Chowk, Mota Varachha, Surat-394 101. Loan No 918030042689453 & 918030042689479 	12.06.2024 & 07.10.2021	on 27.02.2021 & Rs 19,02,594.7/- as	PROPERTY-1 - The Property Bearing Shop No.14 On The 1" Floor Paiki As Per Site Shop No.1030 On The 1" Floor Aqmeasuring 490.43 Sq. Fts. Super Built Up Area & 312.691 Sq. Fts.LE.29.04 Sq.Mts. Built Up Area Along With Undivided Share In The Land of "Mansarovar Plaza of As Per Plan 'B' Wing, as Per Plan Building No. F", Situate At Revenue Survey No.683, Block No.550/A, Admeasuring 7- 38-13 Sq. Mts Aakar Rs.29.89 Paisa Of Moje Kathor, Ta-Kamrej Dist-Surat, and bounded as un- der together with the right to use common areas of the building, the right to use water closet, drainage, lavatories and other conveniences and facilities, amenities in or upon or pertaining to or connected to the flat/ unit / office premises, both present and future and easementary rights and together with all fixtures and fittings, both present and future. Boundaries: East Parking & open Land, West: COP Land & Building A-6 & A-7 Property, North: Wing C Property, South: Society Road PROPERTY-2 - The Property Bearing Shop No.14 On The 1" Floor Paiki As Per Site Shop No.1031 On The I" Floor Admeasuring 548.424 Sq. Fts. Super Built Up Area & 350.58 Sq.Fts.LE.32.57 Sq.Mts. Built Up Area Along With Undivided Share In The Land Of "Mansarovar Plaza of As Per Site 'B' Wing, as Per Plan Building No. F", Situate At Revenue Survey No.683, Block No.550/A, Admeasuring 7- 38-13 Sq. Mts Aakar Rs.29.89 Paisa Of Moje Kathor, Ta-Kamrej Dist-Surat, and bounded as un- der together with the right to use common areas of the building, the right to use water closet, drainage, lavatories and other conveniences and facilities, amenities in or upon or pertaining to or connected to the flat / unit / office premises, both present and future and easementary rights and together all fixtures and fittings, both present and future. Boundaries:- East: Parking & open Land, West: COP Land & Building A-6 & A-7 Property, North: Wing C Property, South: SOCIETY ROAD
5	 1. M/s. VVN IMPEX (Applicant) A-803, Shiv Plaza. Kathodara Road, Opp. Navjivan Hotel, Sarthana Jakat Naka, Varachha Road, Surat-395006. 2. Ritaben Ashokbhai Korat (Proprietor) A-803, Shiv Plaza. Kathodara Road, Opp. Navjivan Hotel, Sarthana Jakat Naka, Varachha Road, Surat-395006. 3. Ashokkumar Parsottambhai Korat (Guarantor) A-803, Shiv Plaza, Kathodara Road, Opp. Navjivan Hotel, Sarthana Jakat Naka, Varachha Road, Surat-395006. Loan Ac. No 919030016239805 	12.06.2024 & 27.06.2021	40,82,993,7 as on 24.02.2021	Property 1 - All that piece and parcel of N.A property bearing Flat No. A-803 on 8th floor built up area admeasuring 58.43 sq. mts and super built up area admeasuring 90.58 sq. mts with undivided share area admeasuring 26.19 sq. mts in "Shiv Plaza" which was Situated at Revenue Survey No. 107/1 paiki, Block No. 109/B area admeasuring 7228 Sq. Mts, Draft T.P. Scheme No. 21 (Sarthana-Simada) adjoining F.P. No. 75/1 its total admeasuring 5723 sq. mts of Moje. Sar- thana, Sub Dist. Kamrej & Dist. Surat. and bounded as under together with the right to use common areas of the building, the right to use water closet, drainage, lavatories and other conveniences and facilities, amenities in or upon or pertaining to or connected to the flat / unit / office premises, both present and future and easementary rights and together with all fixtures and fittings, both present and future. Boundaries:- East: Open Place, West Flat No. A-802, North: Open Place, South Flat No. A-804. PROPERTY-2 All that pieces and parcel of N.A property bearing Shop No. 2 on second floor super built up area 530 sq. feet and built up area admeasuring 27.88 sq. mts in "Global Point" constructed on West side of Sub Plot No. D/1 (according to Revenue record its Block/Survey No. 153/3/paiki/D-1) area adm. 1540 sq. mts which was Situated at Block No. 153-B and Revenue Survey No. 159/3 a admeasuring 6679 Sq. Mts, its T.P. Scheme No. 22 (Sarthana-Valak), F.P. No. 11+12 of Sub Dist. Puna (Surat City). Dist. Surat, and bounded as under fogether with the right to and Mathana. use common areas of the building, the right to use water closet. drainage, lavatories and other conveniences and facilities, amenities in or upon or pertaining to or connected to the flat unit office premises, both present and future and easementary rights and together with all fixtures and fittings, both present and future. Boundaries:- East: Adjoining Block No. 153/B paiki land, West: Adjoining Block No. 153/A, North: Adjoining bhurkhiya row house Plot No. 10, South: Adj, Surat-Kamrej

Please further notice that as mentioned in sub - section 13 of Sec. 13 of the aforesaid Act, you shall not transfer by way of sale, lease or otherwise any of the assets stated under security referred to in this Notice without prior written consent of our Bank. Sd/-, Authorized Officer, Axis Bank Ltd. DATE - 28.06.2024, PLACE - Gujarat

Haldyn Glass-

Place : Mumbai

Date : June 27, 2024

Haldyn Glass Limited

Corporate Off.: B-1201, Lotus Corporate Park, Off Western Express Highway, Goregaon (E) Mumbai- 400063. Tele: 022- 42878900, Fax: 022- 42878910, Website: www.haldynglass.com Regd. Off.: Village Gavasad, Taluka Padra, Dist. Vadodara 391 430 Tele: 2622 243339 Fax: 2622 245081

[Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund (IEPF) Authority]

Notice is hereby given to the shareholders of Haldyn Glass Limited ('the Company") pursuant to the provisions of section 124(6) of the Companies Act, 2013 read with Rule - 6 of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended ("the Rules").

The Rules, amongst other matters, contain provisions for transfer of all shares, in respect of which dividend has not been paid or claimed for seven consecutive years or more, to the demat account of the Investor Education and Protection Fund (IEPF) Authority.

Adhering to the various requirements set out in the Rules, the Company has, so far, transferred to IEPF Authority, on respective due dates, all shares in respect of which dividend(s) for the financial year 2015-16 or before had remained unpaid or unclaimed for a period of seven consecutive years or more. The Company has, vide its letter dated June 24, 2024, (dispatched on June 25, 2024) communicated individually, the concerned shareholders whose shares are liable to be transferred to IEPF Authority during the financial year 2024-25 for taking appropriate action.

The Company has uploaded full details of such shareholders and shares due for transfer to IEPF Authority on its website at www.haldynglass.com.

Shareholders may note that both the unclaimed dividend and the shares transferred to the IEPF Authority including all the benefits accruing on such shares, if any, can be claimed back by them from IEPF Authority after following the procedure prescribed under the Rules.

The concerned shareholders, holding shares in physical form and whose shares are liable to be transferred to the IEPF Authority, may note that the Company would be issuing duplicate share certificate(s) in lieu of the original share certificate(s) held by them for the purpose of dematerialization and transfer of shares to IEPF Authority, as per the Rules and upon such issue, the original share certificate(s) which are registered in their name will stand automatically cancelled and be deemed non-negotiable. The shareholders may further note that the details uploaded by the Company on its website shall be deemed to be adequate notice in respect of issue of new certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF Authority pursuant to the Rules.

In case the Company does not receive any communication (claiming the unclaimed unencashed dividend) from the concerned shareholders on or before October 26, 2024, the Company shall with a view to complying requirements set out in the Rules, dematerialize and transfer the shares to IEPF Authority by way of corporate action as per procedure stipulated in the Rules.

For any queries on the above matter, shareholders are requested to contact the Company's Registrar and Share Transfer Agents - M/s. Link Intime India Pvt. Ltd., C-101, 247 Park, LBS Road, Vikhroli West, Mumbai - 400083. Tel No: +91 22 49186000 Fax No.: +91 22 49186060 E-mail: rnt.helpdesk@linkintime.co.in

> For Haldyn Glass Limited Sd/-**Dhruv Mehta Company Secretary**



BEHRAM CHEMICALS PRIVATE LIMITED

Corporate Identity Number (CIN): U24100MH1993PTC071480 red Office: "Godrej One", 3" Floor, Pirojshanagar, Eastern Express Highway, Vikhroli (East), Mumbai - 400 079, Maharashtra

Tel.: +91 22 2518 8010; E-mail: behram.chemicals@godrejastec.com

NOTICE OF THE 31ST (THIRTY FIRST) ANNUAL GENERAL MEETING & DEMATERIALIZATION OF EQUITY SHARES NOTICE is hereby given that the 31st (Thirty First) Annual General Meeting ("AGM") of the Shareholders of Behram Chemicals Private Limited ("the Company") is scheduled to be held on Thursday, 25th July, 2024 at 12.30 p.m. (IST) at Conference Room No. 24, 3rd Floor, "Godrej One", Pirojshanagar, Eastern Express Highway, Vikhroli (East), Mumbai - 400 079, Maharashtra, to transact the business, as set out in the Notice of the AGM, which, along with the Annual Report for the Financial Year 2023-24, has been posted separately to all the Shareholders at their

In compliance with the provisions of the Companies Act, 2013, the Rules framed thereunder and the Circulars issued by the Ministry of Corporate Affairs (MCA), the Company is desirous of sending electronic copies of the Notice of the AGM and the Annual Report for the Financial Year 2023-24 to all the Shareholders whose e-mail addresses are registered with the Company.

The Shareholders who have not registered their e-mail addresses are requested to get their e-mail addresses registered, by writing to the Company at behram.chemicals@godrejastec.com, along with a copy of the signed request letter mentioning the name and address of the Shareholder, scanned copy of the Share Certificate (front and back), self-attested copy of the PAN Card and self-attested copy of any document (e.g., Aadhaar Card, Driving License, Election Identity Card, Passport) in support of the address of the Shareholder.

As per the notification issued by the Ministry of Corporate Affairs (MCA) dated 27th October, 2023, all the Shareholders are requested to get their Physical Shares dematerialized through their respective Depository Participants (DP) by mentioning the Company's ISIN, i.e., INE03W901013 and can raise any further queries to behram.chemicals@godrejastec.com or to the Company's Registrar and Share Transfer Agent, viz., NSDL Database Management Limited at 4" Floor, "A" Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400 013.

This notice is being issued for the information and benefit of all the Shareholders of

For Behram Chemicals Private Limited

Place: Mumbai Date: 27th June, 2024

(DIN: 07444595)

Anurag Roy

ANAND RATHI

Anand Rathi Global Finance Limited Express Zone, A Wing, 8th Floor, Western Express Highway, Goregaon (E), Mumbai - 400 063 India

POSSESSION NOTICE

POSSESSION NOTICE

Whereas, the Authorized Officer of the Anand Rathi Global Finance Limited, under the Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued Demand Notice (details specifically mention in table below, hereinafter Demand Notice) under Section 13 sub-section 2 of the Securitization And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 calling upon the Borrower(s) (detail specifically mention in table below, hereinafter Borrower (s) to repay the amount mentioned in the Demand Notice together with further and Future interest thereon at the contractual rate of interest together with costs and charges and other monies payable (if any) from the date of Demand Notice onwards, till the date of payment and/or realization by ARGFL within 60 days from the date of receipt of the Demand Notice (hereinafter Amount Due).

days from the date of receipt of the Demand Notice (hereinafter Amount Due). The Borrower (s) and Co-borrower (s) having failed to repay the Amount Due, this notice is hereby given to the Borrower mentioned herein below in particular and public in general that the undersigned has taken Symbolic possession of the properties / Secured Assets (as defined under the Demand Notice) described herein below in exercise of powers conferred upon him/her under sub-section (4) of section 13 of the Securitization And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on the date specifically mention herein below.

The Borrower and Co-borrower (s) in particular and the public in general is hereb cautioned not to deal with the properties/ the Secured Assets and any dealings with the Properties / secured assets will be subject to the charge of Anand Rathi Global Finance Limited for an **Outstanding Amount** (specifically mentioned herein below) together with further and future interest thereon at the contractual rate of interest together with costs and charges and other monies payable (if any) till the date of payment and/or realization by ARGFL. The Borrower's attention is invited to the provisions of sub-section (8) of Section 13 of the Act in respect of the time available to redeem the secured assets.

Borrower (s) Name Address: M/s. Manita Industries 1513-14, Ghanshyam Enclave, Nea alji Pada Police Station, New Link Road, Kandivali (West), Mumbai: 400067

Co-borrower(s) Name Address: 1. Mr. Rajkumar Pawankumar Chopra 2. Mrs. Bindu Rajkumar Chopra Flat No. 405, B Wing, Raj Residency – I CHSL, 4TH Floor, Mahavir Nagar, Kandivali (West), Mumbai: 400 067

ROI Principal Outstanding EMI Amount Pending Broken period interest Over Due interest EMI Bounce charges Legal Charges Notice Charges Total outstanding Amount Due as per Demand Notice with further interest as applicable: Rs. 2,58,70,169/- (Rupees Two Crores Fifty Eight Lakhs Seventy Thousand One Hundred Sixty Nine Only) Date of Demand Notice: 19th April, 2024 Loan Agreement No: APPL00004674 Date of Possession: 27th June, 2024

Property Details: Flat No. 405, B Wing, Raj Residency – I CHSL, 4TH Floor, Mahavir Nagar Dammu Anna Date Marg, Survey No. 144, Hissa No. 1, CTS No. 113 at Village Kandivali Kandivali (West), Mumbai: 400 067

Date: 27th June, 2024 Place: Mumbai

Sd/- Anand Rathi Global Finance Limite Authorized Officer

NOTICE Form no INC-26

[Pursuant to Rule 30 the Companies (Incorporation) Rules, 2014]
Advertisement to be published in the newspaper for change of registered

office of the company from one state to another Before the Central Government

(Regional Director, Western Region, Mumbai)
In the matter of sub-section (4) of Section 13 of Companies Act, 2013 and clause (a) of sub-rule (5) of rule 30 of the Companies (Incorporation)

In the matter of SINO HOT RUNNER INDIA PRIVATE LIMITED (CIN: U74120MH2011PTC219262) having its registered office at 107 A Wing, Evershine Industrial Estate, Chinchpada, Valiv, Vasai (East), Maharashtra - 401208. Petitioner

Notice is hereby given to the General Public that the company proposes to make application to the Central Government power delegated to Regional Director, Western Region, Mumbai under section 13 of the Companies Act, 2013 seeking confirmation of alteration of the Memorandum of Association of the Company in terms of the special resolution passed at the Extra ordinary general meeting held on THURSDAY, 23RD MAY 2024 to enable the company to change its Registered office from "State of

Maharashtra" to "State of Gujarat". Any person whose interest is likely to be affected by the proposed change of the registered office of the company deliver either on the MCA-21 portal (www.mca.gov.in) by filing investor complaint form or cause to be delivered or send by registered post of his/her objections supported by an affida vit stating the nature of his/her interest and grounds of opposition to the Regional Director at the address Everest 5th Floor, 100 Marine Drive, Mumbai - 400002. Maharashtra (email:rd.west@mca.gov.in) within Fourteen days from the date of publication of this notice with a copy of the applicant company at its registered office at the address mentione

SINO HOT RUNNER INDIA PRIVATE LIMITED 107 A Wing, Evershine Industrial Estate, Chinchpada, Valiv, Vasai (East), Maharashtra - 401208. For & On Behalf of Applicant Sino Hot Runner India Private Limited

Date: 28-06-2024

Vishal Brijbeharilal Agarwal (DIN: 02461456) Director



Whereas

Place: Vasai

The Mehsana Urban Co-op Bank Ltd.

(Multi-State Scheduled Bank) d Office: Corporate House, Highway, Mehsana-384002

Phone No. (02762) 257233, 257234

POSSESSION NOTICE

Rule-8(1) (FOR IMMOVABLE PROPERTY)

The undersigned being the authorised officer of the The Mehsana Urban Coop Bank Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest [Act] 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 16.02.2024 calling upon the borrower Bharat Narayan Shelke to repay the amount mentioned in the notice being Rs.30,16,517/- (Rupees Thirty Lacs Sixteen Thousand Five Hundred and Seventeen only) upto 31-01-2024 with date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said [Act] read with rule 9 of the said rules on this 14-06-2024.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the The Mehsana Urban Co-op Bank Ltd. for an amount Rs.30,16,517/- (Rupees Thirty Lacs Sixteen Thousand Five Hundred and

Description of the Immovable Property. All the piece and parcels of Immovable Property/ies situated at Flat bearing

No. 703, admeasuring 225 sq.ft. of carpet area on 7th floor, of Building No. R-2 Golden CHS Ltd Opp. RTO Office, Adj to Orbit Tower Garodia Nagar Behind Eastern Express Highway, Ghatkopar East Mumbai 400077 constructed on a piece and parcel of land bearing Plot No. 3, 4 & 5 Survey No. 236 A (pt) of CTS No. 194A (pt) situated, lying and being at Village Ghatkopar.

Date: 26-06-2024 **Authorised Officer** Place: MUMBAI The Mehsana Urban Co-op Bank Ltd.

IN THE COURT OF CITY CIVIL AT DINDOSHI (MUMBAI). Commercial Suit No. 703 OF 2023

CANARA BANK, Banking Company functioning under the provisions of the Banking Companies (Acquisition and Transfers of Undertakings Act, 1970 having its Registered Office at Bangalore-560 004, and Branch Office, at Takshashila, Plot No.1 Samant Estate, Goregaon, (E), Mumbai - 400063.

1. Mr. Rahul Kevalashankar Shukla Prop. of R.K. Agency, age about years, Flat No 403, Akruti Trade Point, Building No.4, Shankarwadi, Jogeshwari (E), Mumbai - 400064. Mob No. 771501109, 9892368222, Office at Pascal Colony, Opp. Infant Jesus High School Shankarwadi, Jogeshwari

(E), Mumbai - 400064.

TAKE NOTICE that, Plaintiffs will be moved before this Hon'ble Addl. City Civil and Session Judge Presiding in the Court No. 2, on 3rd July 2024, at 11. O. Clock, in the forenoon by the above named plaintiff for the following reliefs:-The Plaintiffs, therefore pray:

a. That the Defendant be ordered and decreed to pay to the Plaintiff a sum of

Rs. 5,64,097.92, (Rupees Five Lac Sixty Four Thousand Ninety Seven and Paise Ninety Two only), till 31.05.2023 with interest calculated and further interest @. 10.85%,p.a with monthly rests from 01.06.2023 till final payment and/or realization thereof on Rs. 5,64,097.92 (Rupees Five Lac Sixty Four Thousand Ninety Seven and Paise Ninety Two only), as per particulars of claim being Exhibit

That cost including professional costs be provided for; That such other and further reliefs as the nature of the of the case may require and as this Hon'ble Court may deem fit and proper be granted.

Sd/-

502, on 5th Floor, Paras Business Center, Cross Road No.1, Borivali (E), Mumbai - 6

केनरा बैंक Canara Bank

सिंडिकेट Syndicate

LOWER PAREL BRANCH: Unit No. 1, Ground Floor, Kamala Mills Compound Times Tower, S. B. Road, Lower Parel (West), Mumbai-400 013, Maharashtra

POSSESSION NOTICE (SECTION 13(4))

(For Immovable Property)
WHEREAS: The undersigned being the Authorised Officer of the Canara Bank,
LOWER PAREL Branch, appointed under Securitisation And Reconstruction of inancial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) nereinafter referred to as "the Act") and in exercise of powers conferred unde section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 ssued a Demand Notice dated 15.04.2024 and published in 2 Newspapers or 25.04.2024 calling upon the borrower, Mrs. Faizunnisa Hasan Shaikh, Ro Room No. 102 Shivam CHS., Mukund Nagar, Damber Compound, Opp. ONGC Dharayi, Mumbai, Maharashtra-400 017 and also at R/o. Residential Flat bearing Dharavi, Mumbai, Manarasmra-400 017 and also at tr/o. Residential Flat bearing Flat No. 101 on 1st floor in 'B' wing of the building known as "Viviana Block 5" situated at village Dhamote, Taluka Karjat & District Raigad, Maharashtra, to repay the amount mentioned in the notice, being ₹ 22,08,397.86 (Rs. Twenty Two Lakhs Eight Thousand Three Hundred Ninety Seven and Paisa Eighty Six only) as on 14,04,2024 plus interest due and other cost within 60 days from the date of receipt of the said notice.

The borrower / Guarantor having failed to repay the amount, notice is hereby

given to the borrower and the **public in general**, that the undersigned has taken **SYMBOLIC POSSESSION** of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this **26th day of June 2024.** The borrower in particular and the **public in general** are hereby cautioned not to

deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank, Lower Parel Branch for an amount of ₹ 22,08,397.86 (Rs. Twenty Two Lakhs Eight Thousand Three Hundred Ninety Seven and Paisa Eighty Six Only) as on 14.04.2024. The borrower's attention is invited to the provisions of Section 13 (8) of the Act, in

spect of time available, to redeem the secured assets

Pescription of the Immovable Property.

All that part and parcel of property bearing details: Residential Flat bearing Flat No. 101 admeasuring 337.99 Sq. Ft. carpet area on 1st floor in 'B' wing of the building known as "Wiviana Block 5s" constructed on land bearing Survey No. 87/43, 87/44, 87/45, 87/46 situated at Village Dhamote, Taluka Karjat & District Reigad, Maharashtra. *Bounded as follows: North: open land; South: Open land; ; • East : Road; • West : Open Land. • Name of Title Holder : Mrs. Faizunnisa Hasan Shaikh

Authorised Officer Canara Bank Place: Lower Parel



The Mehsana Urban Co-op Bank Ltd.

(Multi-State Scheduled Bank) Head Office: Corporate House, Highway, Mehsana-384002 Phone No. (02762) 257233, 257234

POSSESSION NOTICE Rule-8(1) (FOR IMMOVABLE PROPERTY)

13.00% 2,44,20,554 12,62,866 97,004 67,345 11,800 9,500

The undersigned being the authorised officer of the The Mehsana Urban Coop Bank Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest [Act] 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 16.02.2024 calling upon the borrower Omkar Brijbhushan Yadav, Aditya Brijbhushan Yadav and Brijbhushan Sonai Yadav to repay the amount mentioned in the notice being Rs.50,77,970/- (Rupees Fifty Lacs Seventy Seven Thousand Nine Hundred and Seventy only) upto 31-01-2024 with date of

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said [Act] read with rule 9 of the said rules on this 10-05-2024.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the The Mehsana Urban Co-op Bank Ltd. for an amount Rs.50,77,970/- (Rupees Fifty Lacs Seventy Seven Thousand Nine Hundred and Seventy only) and interest thereon.

Description of the Immovable Property.

All the piece and parcels of Immovable Property/ies situated at Flat bearing No. 403, admeasuring 400 sq.ft. of carpet area on 4th floor, B Wing Shri Mangleshwar Heights, Nr. Fatima Church, Village Majiwada Tal & Dist. Thane 400601. constructed on a piece and parcel of land bearing CTS No. 125 to 128. The society known as Shri Mangleshwar Heights Co-op HSG Society situated at Majiwada, Thane West.

Date: 26-06-2024 Place: MUMBAI

Authorised Officer

Haldyn Glassud

Place: Mumbai

Date: June 27, 2024

The Mehsana Urban Co-op Bank Ltd.

Haldyn Glass Limited CIN: L51909GJ1991PLC015522

Corporate Off.: B-1201, Lotus Corporate Park, Off Western Express Highway, Goregaon (E) Mumbai - 400063. Tele: 022-24878900, Fax: 022-48878910, Websit Express riginway, Goregaon (E) Regd. Off.: Village Gavasad, Taluka Padra, Dist. Vadodara 391 430 Tele: 2622 243339 Fax: 2622 245081

NOTICE [Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund (IEPF) Authority]

Notice is hereby given to the shareholders of Haldyn Glass Limited ('the Company' pursuant to the provisions of section 124(6) of the Companies Act, 2013 read with Rule -6 of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended ("the Rules").

The Rules, amongst other matters, contain provisions for transfer of all shares, in respect of which dividend has not been paid or claimed for seven consecutive years or more, to the demat account of the Investor Education and Protection Fund (IEPF) Authority.

Adhering to the various requirements set out in the Rules, the Company has, so far transferred to IEPF Authority, on respective due dates, all shares in respect of which dividend(s) for the financial year 2015-16 or before had remained unpaid or unclaimed for a period of seven consecutive years or more. The Company has, vide its letter dated June 24 2024, (dispatched on June 25, 2024) communicated individually, the concerned shareholders whose shares are liable to be transferred to IEPF Authority during the financial year 2024-25 for taking appropriate action.

The Company has uploaded full details of such shareholders and shares due for transfer to IEPF Authority on its website at www.haldynglass.com.

Shareholders may note that both the unclaimed dividend and the shares transferred to the IEPF Authority including all the benefits accruing on such shares, if any, can be daimed back by them from IEPF Authority after following the procedure prescribed under the Rules. The concerned shareholders, holding shares in physical form and whose shares are liable to be transferred to the IEPF Authority, may note that the Company would be issuing

duplicate share certificate(s) in lieu of the original share certificate(s) held by them for the purpose of dematerialization and transfer of shares to IEPF Authority, as per the Rules and upon such issue, the original share certificate(s) which are registered in their name will stand automatically cancelled and be deemed non-negotiable. The shareholders may further note that the details uploaded by the Company on its website shall be deemed to be adequate notice in respect of issue of new certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF Authority pursuant to the Rules.

In case the Company does not receive any communication (claiming the unclaimed nencashed dividend) from the concerned shareholders on or before October 26, 2024, the Company shall with a view to complying requirements set out in the Rules materialize and transfer the shares to IEPF Authority by way of corporate action as per procedure stipulated in the Rules.

For any gueries on the above matter, shareholders are requested to contact the Company's Registrar and Share Transfer Agents - Ws. Link Intime India Pvt. Ltd., C-101, 247 Park, LBS Road, Vikhroli West, Mumbai - 400083. Tel No: +91 22 49186000 Fax No.: +91 22 49186060 E-mail: rnt.helpdesk@linkintime.co.in

For Haldyn Glass Limited Dhruy Mehta Place: Mumbai

Company Secretary



PUBLIC NOTICE

lotice is hereby given to that the be Property, belonging to Mr. Javes Prabhashankar Joshi and Mrs. Manjulaben Prabhashankar Joshi, is a secured asset being nortgaged / charged to **Pegasus Assets Reconstruction Private Limited** (acting in its capar as trustee of Pegasus Group Thirty Nine Trust 1) ("Pegasus") for the credit facilities availed it ÖJEX Biochem Pvt. Ltd. from RBL Bank Ltd. assigned the debt of CJEX Biochem Pvt. Ltd. along with underlying security interest to Pegasus having address at 55-56, 5th Floor, Free Press House, Free Press Journal Marg, Nariman Point, Mumbai – 400 021, Ph. No. 022-61884700/022-61884722, under the aegis of SARFAESI Act.
Mr. Jayesh Prabhashankar Joshi / Mrs. Manjulaben Prabhashankar Joshi / CJEX Biochem Pvi

Ltd. and/or its Partners/ Mortgagors/ Guarantors in particular and the public in general are hen by CAUTIONED NOT TO DEAL with the below mentioned Immovable Property and ar ealings with the same shall be subject to charge of Pegasus Assets Reconstruction Private Limite

DESCRIPTION OF THE PROPERTIES Flat No. 9, 2nd Floor, Adm. 530 sq. ft. built up area, Seeta Mahal Co-Operative Housing Societ 12 A Bomanji Petit Road, Near Kemps Comer, Pedder Road, Mumbai- 400 026.

For, Pegasus Assets Reconstruction Pvt. Ltd Date: 27/06/2024 Trustee of Pegasus Group Thirty Nine Trust- 1

STATE BANK OF INDIA PREMISES & ESTATE DEPARTMENT

LOCAL HEAD OFFICE, MUMBAI METRO 3rd Floor, Synergy Building, Bandra Kurla Complex, Bandra East, Mumbai − 400 051

EMPANELLMENT OF ELECTRICAL SAFETY AUDITORS

State Bank of India, invite expression of interest for empanelment of Electrical Safety Auditors for Branches/ Offices under control of Mumbai Metro Circle. For further details and downloading Tender Document, please visit Bank's website www.sbi.co.in, "SBI in the News" link "Empanelment of Vendors". Application must be submitted online through portal https://etender.sbi/SBI/ on or before 3.00 pm on 19.07.2024. Further Notice/ Clarification in this regard will be posted only on the Banks above mentioned web site. S/D

Assistant General Manger (P&E)

THE SPECIAL RECOVERY OFFICER Authorised U/Section 156(1) of M.C.S.Act 1960 and there under Rule 107 of M.C.S.Rule 1961

First Floor, Near Nitin Co., Signal, Eastern Express Highway, Thane (w) 400 604

[See Sub-Rule [11(D-1)] of Rule 107]

Sahakari Patpedhi Limited, Mumbai, under the Maharashtra Co-operative Societies Rules, 1961, issued a demand notice dated 03/02/2024 calling upon the judgment debtors 1. MR. SOURABH VIJAY CHOUGULE 2. SMT. SANITA VIJAY CHOUGULE 3. MR. GHANASHYAM BALKRISHNA VENGURLEKAR 4. MR. KHEMRAJ ANANT PARULEKAR AND 5. MR. HEMANT KAMLAKAR VAIGANKAR to repay an amour mentioned in the notice being Rs. 11,25,786/- (Rupees ELEVEN LAKH TWENT) FIVE THOUSAND SEVEN HUNDRED EIGHTY SIX Only) within a period of 15 (fifteen) days from the date of receipt of the said notice and the judgment debtor having failed to repay amount, the undersigned has issued a notice before attachment dated 20/02/2024 and attached the property described herein below.

The judgment debtors having failed to repay the amount, notice is hereby given to the judgment debtors and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him under Rule 107 [11(d-1)] of the Maharashtra Co-operative Societies Rules, 1961, on this 26/06/2024

CHOUGULE in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Shivkrupa Sahakari Patpedhi Limited, Mumbai, for an amount Rs 10,75,068/ (Rupees TEN LAKH SEVENTY FIVE THOUSAND SIXTY EIGHT Only) and interes

 Flat No 305, A Wing, Third Floor, Dhamale Niwas, Near Lakadi Pool, Lokmanya Nagar, Thane (w) - 400606. PROPERTYNO. 9082027, Pada No. 3

Date - 26/06/2024

SPECIAL REOVERY OFFICER Authorised U/s 156(1) of M.C.S.Act 1960 And there under Rule 107 of M.C.S.Rule 1961

THE SPECIAL RECOVERY OFFICER Authorised U/Section 156(1) of M.C.S.Act 1960 and there under Rule 107 of M.C.S.Rule 1961

Attached To The Shivkrupa Sahakari Patpedhi Ltd., Mumbai, 203, Suryadarshan Tower, First Floor, Near Nitin Co., Signal, Eastern Express Highway, Thane (w) 400 604

[See Sub-Rule [11(D-1)] of Rule 107]

POSSESSION NOTICE FOR IMMOVABLE PROPERTY

Whereas the undersigned being the Special Recovery Officer attached to Shivkrupa Sahakari Patpedhi Limited, Mumbai, under the Maharashtra Co-operative Societies Rules, 1961, issued a demand notice dated 01/02/2023 calling upon the judgmer debtors 1. MR. NAGLOTI ERANNA PRABHANNA 2. MR. NAGLOTI MALLIKARJUN PRABHANNA 3. MR. MAHESH ERAPPA SAMAGANDI 4. MR MAYUR ERAPPA SAMAGANDI 5. MR. NARAYAN TANAJI SHELAR AND 6. MR. AMAR VASANT NIMBALKAR to repay an amount mentioned in the notice being Rs. 27,78,406/- (Rupees TWENTY SEVEN LAKH SEVENTY EIGHT FORTY SIX Only) within a period of 15 (fifteen) days from the date of receipt of the said notice and the judgment debtor having failed to repay amount, the undersigned has issued a notice before attachment dated 17/02/2023 and attached the property described

The judgment debtors having failed to repay the amount, notice is hereby given to the judgment debtors and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him under Rule 107 [11(d-1)] of the Maharashtra Co-operative Societies Rules, 1961, on this 26/06/2024

The judgment debtors MR. NAGLOTI ERANNA PRABHANNA and MR. NAGLOTI MALLIKARJUN PRABHANNA in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Shivkrupa Sahakari Patpedhi Limited, Mumbai, for an amount Rs 22,57,720/- (Rupees TWENTY TWO LAKH FIFTY SEVEN THOUSAND SEVEN HUNDRED TWENTY Only) and interest thereon.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY ROOM NO. 555, GROUND + 1 FLOOR, CHAWL NO. 77, SHIVSHAKTI CHSL. SHIVAI NAGAR, POKHARAN ROAD NO. 1, THANE (W) -400 604.

Date - 26/06/2024

SURYAKANT PANDIT KUMBHAR SPECIAL REOVERY OFFICER Authorised U/s 156(1) of M.C.S.Act 1960

And there under Rule 107 of M.C.S.Rule 1961

Attached To The Shivkrupa Sahakari Patpedhi Ltd., Mumbai, 203, Suryadarshan Towe First Floor, Near Nitin Co., Signal, Eastern Express Highway, Thane (w) 400 604 FORM 'Z' [See Sub-Rule [11(D-1)] of Rule 107]

Whereas the undersigned being the Special Recovery Officer attached to Shivkrupa Sahakari Patpedhi Limited, Mumbai, under the Maharashtra Co-operative Societies Rules, 1961, issued a demand notice dated 07/07/2018 calling upon the judgmen debtors 1. MR. SATISH SHANTARAM KASHTE 2. MR. AJAY SHANTARAM KASHTE to repay an amount mentioned in the notice being Rs. 7,40,414/- (Rupees SEVEN LAKH FOURTY THOUSNAD FOUR HUNDRED FOURTEEN Only) within a period of 15 (fifteen) days from the date of receipt of the said notice and the judgment debtor having failed to repay amount, the undersigned has issued a notice before attachment dated 06/08/2018 and attached the property described herein

The judgment debtors having failed to repay the amount, notice is hereby given to the judgment debtors and the public in general that the undersigned has taken symbolic possession of the property described herein below in exercise of powers conferred on him under Rule 107 [11(d-1)] of the Maharashtra Co-operative Societies Rules, 1961, on this 22/01/2020

SHANTARAM KASHTE in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Shivkrupa Sahakari Patpedhi Limited, Mumbai, for an amount Rs 6,46,953/- (Rupees SIX LAKH FOURTY SIX THOUSAND NINE HUNDRED FIFTY THREE Only) and interest thereon.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY SHIVKRUPA CHAWL, ROOM NO. 10, NEAR DATTA TEMPLE, RAMCHANDRA

Date - 22/01/2020 Place - THANE

SPECIAL REOVERY OFFICER Authorised U/s 156(1) of M.C.S.Act 1960 And there under Rule 107 of M.C.S.Rule 1961

FORM NO. URC-2

ment giving notice about registrat Part I of Chapter XXI of the Act [Pursuant to section 374(b) of the Companies Act, 2013 and Rule 4 (1) of the Companies (Authorised to Register) nd Rule 4 (1) of the Com

nd Rule 4 (1) of the Companies (Authorised to Register)
Rules, 2014]

Notice is hereby given that in pursuance of
sub-section (2) of Section 366 of the Companies Act,
2013, an application is proposed to be made after fifteen days hereof but before the expiry of thirty days hereinafter to the Registrar at Mumbai that "COPIEUX TECHKNOWLEDGE ANALYTICS LLP (LLPIN: AAQ-3691)" a LLP may be registered under Part I of Chapter XXI of the Companies Act 2013, as a Company limited by shares.

The principal objects of the company are follows:

All the activities related to information technologies software development, human resource management and data collection. Information Technology and its related service include in NIC 62099,78300

A copy of the draft Memorandum and Articles of

Association of the proposed Company may be inspected at the Registered Office at Office No HD-175 WeWork 247 Park, 13th Floor, Vikhrol Corporate Park, Hindustan C. Bus Stop, La Bahadur Shastri Rd, Gandhi Nagar, Vikhroli West, Mumbai, MH 400083 1. Notice is hereby given that any person objecting t this application maycommunicate their objection in writing to the Registrar at Central Registration

Centre (CRC), Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 6,7, 8, Sector 5, IMT Manesar, District Gurgaon (Haryana), Pin Code-122050, within twenty one days from the date of publication of this notice, with a copy to the Company at its

BHAGWANT PRABHAKAR MANE (Designated Partner MAHEK BHARAT KAPADIA (Designated Partner SATISH SHRIPAD SAMARTH (Designated Partner

Date: 28.06.2024 | Place: Mumbai

ASTEC

ASTEC LIFESCIENCES LIMITED Corporate Identity Number (CIN): L99999MH1994PLC076236
Registered Office: "Godrej One", 3st Floor, Pirojshanagar, Eastern Express Highway,

Vikhroli (East), Mumbai – 400 079, Maharashtra Tel.: +91 22 2518 8010; Website: www.godrejastec.com; E-mail: astecinvestors@godrejastec.com NOTICE TO THE SHAREHOLDERS FOR THIRTIETH ANNUAL GENERAL MEETING ("30TH AGM")

NOTICE is hereby given that the Thirtieth Annual General Meeting ("30" AGM") of the Shareholders of ASTEC LIFESCIENCES LIMITED ("the Company") will be held on Monday, 29th July, 2024 at 4.00 p.m. (IST) through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") to transact the business, as set out in the Notice of the AGM. The Ministry of Corporate Affairs ("MCA") had, vide its General Circular No. 14/2020 dated 8th April, 2020, General Circular No.17/2020 dated 13th April 2020, General Circular No. 20/2020 dated 5th May, 2020, General Circular No.02/2021 dated 15th January, 2021, General Circular No. 19/2021 dated 8th December, 2021, General Circular No. 21/2021 dated 15th May, 2022, General Circular No. 21/2022 dated 5th May, 2022, General Circular No. 21/2021 dated 15th May, 2022, General Circular No. No. 10/2022 dated 28th December, 2022 and General Circular No. 09/2023 dated 25th September, 2023 (collectively referred to as "MCA Circulars")

Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") and MCA Circulars, the 30th AGM of the Company will be conducted through VC / OAVM. ELECTRONIC COPIES OF NOTICE OF AGM AND ANNUAL REPORT FOR THE FINANCIAL YEAR 2023-24: compliance with the provisions of the Act, the Rules framed thereunder, MCA Circulars and SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79

rmitted the holding of the Annual General Meeting ("AGM") through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM"), without the

physical presence of the Members at a common venue. In compliance with the provisions of the Companies Act, 2013 ("the Act"), the Securities and

lated 12th May, 2020, Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated 15th January, 2021, Circular No. SEBI/HO/CFD /CMD2/CIR/P/2022/ 62 dated 13th May, 2022, Circular No. SEBI/HO/CFD/Pod-2/P/CIR//2023/4 dated 5th January, 2023 and Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/ 2023/167 dated 7th October, 2023, electronic copies of the Notice of the AGM and the Annual Report for the Financial Year 2023-24 will be sent to all the Shareholders through whose e-mail addresses are registered with the Company / Depository Participant(s). The same will also be made available on the Company's website at www.godrejastlec.com, on the websites of the Stock Exchanges where the Equity Shares of the Company are listed, i.e. BSE Limited www.godrejastlec.com, on the websites of the Stock Exchanges where the Equity Shares of the Company are listed, i.e. BSE Limited www.bseindia.com) and National Stock Exchange of India Limited www.nseindia.com) and on the website of National Securities Depository Limited (NSDL) (www.evoting.nsdl.com).

PARTICIPATION IN AGM THORUGH VC / OAVM

Shareholders can attend and participate in the AGM through the VC / OAVM facility only [which is being availed by the Company from National Securities Depository Limited ("NSDL")], the details of which will be provided by the Company in the Notice of AGM, Shareholders attending through VC /OAVM shall be counted for the purpose of the quorum under Section 103 of the Companies Act, 2013. MANNER OF REGISTERING / UPDATING E-MAIL ADDRESS:

Shareholders who have still not registered their e-mail ID are requested to get their e-mail ID registered, as follows:

are requested to update the same by sending duly filled Form ISR-1 to the Registrar and Share Transfer Agent of the Company, viz., Bigshare Services Private Limited ("Bigshare") at www.bigshareonline.com along with copy(ies) of the requisite document(s) in support of the address of the Shareholder. The said form is available on the Company's website at the weblink https://www.godrejastec.com/investors/investor-service-request Shareholders holding Shares in Dematerialized Mode: Shareholders are requested to register their e-mail ID with the relevant Depository Participant(s).

Shareholders holding Shares in Physical Mode: Shareholders holding shares in physical mode and who have not updated their e-mail address

n case of any queries / difficulties in registering the e-mail address, Shareholders may write to the Company and / or Bigshare at investor@bigshareonline.com

MANNER OF VOTING ON RESOLUTIONS PLACED BEFORE THE AGM: The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its Shareholders to cast their votes on all resolutions set out in the Notice of the 30th ÅGM. Additionally, the Company is also providing the facility of voting through e-voting system during the AGM ("e-voting"). The manner of the remote e-voting / e-voting for the Shareholders holding Shares in dematerialized mode, physical mode, and for the Shareholders who have not registered their e-mail addresses will be provided in detail, in the Notice of the AGM.

BOOK CLOSURE: The Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Wednesday, 24th July, 2024 to Sunday, 28th July, 2024 (both days inclusive) for annual closing.

Date: 27th June, 2024

TAX DEDUCTED AT SOURCE (TDS) CERTIFICATE IN RESPECT OF FINAL DIVIDEND DECLARED AT THE PREVIOUS AGM The certificates with respect to TDS on Final Dividend paid by the Company for the Financial Year 2022-23, as declared by the Shareholders at the previous 29th AGM held on 27th July, 2023 (payment made during the Financial Year 2023-24) are available for the concerned Shareholders to download from the Company's website at https://www.godrejastec.com/investors/tds-certificates-shareholders, through a simple and secured OTP-based downloading process. In case of any doubt / query / difficulty, the concerned Shareholder(s) may please write to us at astecinvestors@godrejastec.com.

> Tejashree Pradhan Company Secretary & Compliance Officer

For ASTEC LIFESCIENCES LIMITED

for COPIEUX TECHKNOWLEDGE ANALYTICS LLP

PUBLIC NOTICE This is to inform/notice you that my Client Sandesh Bhauran Wankhede & Mrs Reshma

Sandesh Wankhede, wish to purchase the below mentioned Flat premises from Mrs Pramila Ramesh Pawar That one Mr. Ramesh Shankar Pawar wa Original owner of below mentioned Flat premises and he was member of Siddharth Nagar CHS Ltd; and on 02.02.2024 concerne authorities of Society Transferred the Share Certificate in name of his wife Mrs. Pramila

Ramesh Pawar and said Mr. Ramesh

Shankar Pawar expired on 30.12.2015 and Smt Pramila Wio Ramesh Pawar as his Wife she is legal heir So if any legal heir, person/s, bank, societ or company have any claims, rights, interes title, objections in respect of below mentione premises then submit it at my below address within 7 days from this notice, failing which any claim/s, shall be considered as waived

off/ abandoned/ given up or surrendered and

Date: 28/06/2024

are not binding on my client DESCRIPTION OF THE PROPERTY Flat No. 505, Building No. 3, adm. 225 carpe on 5th Floor, Siddharth Nagar CHS Ltd; Vikhroli W, Mumbai- 400079.

Adv. R. K. Singh

Colony, Chandivali, Mumbai -400072 Mobile No. 9967180697

PUBLIC NOTICE

32/A/002, Sahyadri Society, Mhada

Notice is hereby given that the Shai Certificates Nos.2336 & 5172 bearir distinctive Nos.1096791 to 1097142 8 481419945 to 481420296 for 704 (Seven Hundred Four) equity shares of Tech Mahindra Limited under Folio No.0003784 standing in the name of Mohan Rochiran and undersigned has applied to the compan for issue of duplicate share certificates for the said shares. Any person(s) who has claim in respect of the aforesaid shares should lodge claim for the same with the Company as its Registered office: Gateway Building, Apollo Bunder, Mumbai 400001 If within 15 days from the date of publication hereof; no claim is received by the Company in respect of the said Share Certificates the Company will proceed to issue duplicate share certificates and thereafter no claim

Name of Share Holder Mohan Rochiram Manglani Date : 28th June, 2024 Place: Mumbai

will be entertained.

For Registrar City Civil Court, Bombay (Seal) Dated This 21st day of June, 2024

Adv. R.C. Dubey

ttached To The Shivkrupa Sahakari Patpedhi Ltd., Mumbai, 203, Suryadarshan Tower,

POSSESSION NOTICE FOR IMMOVABLE PROPERTY Whereas the undersigned being the Special Recovery Officer attached to Shivkrupa

The judgment debtors MR. SOURABH VIJAY CHOUGULE AND SMT. SANITA VIJAY

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

T.M.C. PROPERTY NO. 8082710 BLOCK NO. 81, HOUSE NO. 52. OPP. VIJA NAGAR PIPELINE, VARTAK NAGAR, POKHARAN ROAD NO. 1 THANE -400 606

SURYAKANT PANDIT KUMBHAR

THE SPECIAL RECOVERY OFFICER Authorised U/Section 156(1) of M.C.S.Act 1960 and there under Rule 107 of M.C.S.Rule 1961

POSSESSION NOTICE FOR IMMOVABLE PROPERTY

The judgment debtors MR. SATISH SHANTARAM KASHTE and MR. AJAY

NAGAR NO. 1, KAMGAR HOSPITAL ROAD, THANE (W) 400 604 VAIBHAV CHANDRAKANT JAGTAP



VIEW ARTICLES

Media Group All rights reserved